

१८ अंथमाला नं४३. १

देवीरम्

मनिजयण्डगुणि रचित

३०७९ गारामा स्तवन मूल तथा

भाषान्तर सहित.

ચુલ્દા

ਪੰਨਾਸਲ ਅਤੀਵਾਨਦਿਗੁਰਖਲੁਗਥਿ.

पूज्यपाद परम शुद्ध श्रीभद्राचार्य श्री विजयनिर्दि
स्तुतिरत्ना सहपदेशी.

पाठ्य निवारी भर्तुभ शा हीरचंद दोहतचंदना
समरण पै

તेमन्हा सुपुत्र शा. मरुलाल हीराचंदनी आथी
सुहुःय॒।

छपावी प्रसिद्ध करनारा

श्री हेमचन्द्राचार्य वृत्त संक्षिप्त

मि. अमृत्यु. (लेट).

શ્રીહેમયન્દ્રાચાર્ય જૈન અંથમાલા નંબર. ૧

વન્દે વીરમ्.


પંડિત શ્રીપદવિજયળગણિ રચિત.

શ્રી દીવાલી સ્તવન મૂલ તથા ભાષાન્તર સહિત.

વીસસ્થાનકની નવપદજીની શાન પંચમીની તપની વિધિ. દીવાલીનું ગરણ્યું, દીવાલીના તથા નવપદજીના ચૈત્યવંદનો, સ્તવનો, સુતિઓ, તેમજ પરમપૂજય ગુરુ મહારાજ શ્રી જૈતમ સ્વામીનો રાસ અર્થ સહિત.

પૂજયપાદ પરમ ગુરુ શ્રીમહાચાર્ય શ્રી વિજયનિતિ સૂરીધરજીના સહૃપદેશથી.

પાઠણ નિવાસી મર્ગમ શા. દીરાચંદ દોલતચંદના સમરણાયે તેમના સુપુત્ર શા. મણીલાલ દીરાચંદની આર્થિક સહાયથી.



યોજણ.

પંચાસણ શ્રીદાનવિજયળગણિ.

છપાવી પ્રસિદ્ધ કરનાર.

શ્રીહેમયન્દ્રાચાર્ય જૈન સભાના સેકેટરી.

શા. કેશવલાલ પ્રેમચંદ. બી. એ. એલ. એલ. બી.
હાઇકોર્ટ વકીલ.

દા. હાજરેલની પોણ-અમહાવાદ.

સંવત ૧૯૭૭. પ્રત. ૧૦૦૦. સંત ૧૯૨૦ અ.વૃત્તિ. ૧ લી.

વીર સંવત ૨૪૧૭.

શ્રી ‘સત્યવિજય’ પ્રીન્ટિંગ પ્રેસમાં શા. સાંકલચંદ હરીલાલે
છાયાં. ડે. પાંચકુંઠ નવા. દરવાજા-અમહાવાદ.

કી. અમૃત્ય (લેટ.)

અર્પણ પત્રીકા.

મુજયપાદ પરમ ગુરુ શ્રીમહાયાર્થ શ્રીવિજયનિતિ મુરીશ્વરજી
મહારાજ સાહેબના ચરણકુમલમાં

આપસાહેય. શાંત, દાંત-ગાંભીર્યાદિક અનેક ગુણોએ કરી ખીરા-
જમાન હોધ. દેશાનું દેશ વિહાર કરી. કોઈ જતના ભત ભતાંતર કે
ખેડામાં નહિં પડતાં, પોતાના અને પરના આત્માને શાંતિ આપ-
નારા છો. વલી ભવ્ય જીવને જિત્ત ઉપદેશામૃત વાણી વડે સિંચન
કરી સમકિતિષ્પી રતને પ્રગટ કરાવનારા છો. મને પણ બચપણમાં
(બાધ્ય અવસ્થામાં) જાનતો બોધ આપી અજ્ઞાનપણામાંથી
બચાવનાર પણ આપ જ છો આપણો ભારા ઉપર ધર્ષણાજ
ઉપકાર છે તે પ્રેમથી, તથા ગુરુ ભક્તિથી આ લધુ પુસ્તક
આપને જ અર્પણ કરું છું. તે આપ સ્વીકારશોઇ.

લી. આપનો સદાનો સેવક.

૩૩. મણીલાલ હીરાચંદ.

અનુક્રમણિકા.

પાનુ.

| | | | | |
|--------------------------------|-----|-----|-----|-------|
| ૧ દીવાલી સ્તવન અર્થ સંકિદ. | ... | ... | ... | -૧-૪૩ |
| ૨ વીસ સ્થાનક વિગેરે વિધિ. | ... | ... | ... | ૪૪-૪૮ |
| ૩ ચૈત્યવંદનો. ૫. | ... | ... | ... | ૪૮-૫૧ |
| ૪ સ્તવનો. ૧૩ | ... | ... | ... | ૫૨-૬૨ |
| ૫ સ્તુતિઓ. ૫ | ... | ... | ... | ૬૨-૬૫ |
| ૬ ગૈતમ સ્વામીનો રાસ અર્થ સાથે. | ... | ... | ... | ૬૬-૮૦ |

॥ॐ नमः सिद्धम् ॥ ॐ हौंशी श्री गुरु गौतमाय नमः ॥

श्री दीपाली स्तवन अर्थसहित.

ਫਾਲ ਪਛੇਕੀ. ਰਾਗ ਰਾਮਗਿਰਿ.

પ્રથમ એક પીડીકા-કુગમગ દીપિકા-એ રાગ.

श्री श्रमण संघ तिलकोपमं गौतमं, सुगति प्रणिपत्य पादा-
रविंदः; इन्द्रभुति प्रभव महसो मोचकं, कृत कुशल कोटि
कल्याण कंदं. १

ભાવાર્થ:- શ્રી મુનિરાજના સમુદ્દરમાં તિલક સરખા,
ગૈતમ ગોત્રવાળા, તેમને તથા સદ્ગતિ આપનાર છે ચરણું
કુમળ, જેમના એવા તથા ઈન્ડ ભૂતિ ગણધર પ્રભુ પાપથી
મૂક્તવતારા, કરેલ છે કુરીણ જેમણે એવા, અને કરેલે
ગમે કલ્યાણ (સુખ) ના કંદુંપ એવા (શ્રી ગૈતમ સ્વામિ)
ને નમસ્કાર કરીને. ॥ ૧ ॥

मुनि मन रंजणो, सयल दुःख भंजणो, वीर वर्धमानो
जीणंदो; मुगति गति जीम लही, तिम कहुं सुण सही, जीम
होए हर्ष हइडे आणंदो. मु० २

ભાવાર્થ-મુનિના મનને રંજન કરવા વાળા, અને સર્વું
હું ખને લાંગવા વાળા એવા વીર (મહા પરાક્રમી) શ્રી વર્ધ-
માન જુનેથર ને રીતે મોદ્દું પારયા તે રીતે હું અહિં (શ્રી

મહાવીર નિર્વાખુની સ્તુતિ) કહું છું તે સાંભળો કે જેથી
જુદ્ધયમાં હું અને આનંદ ઉત્પત્ત થાય. ॥ ૨ ॥

કરીય ઉદ્ઘોષણા દેશપુર પાટણે, મેઘ જીમ દાન જલ
બહૂલ વરસી; ધણ કણગ મોતિયા ઝગમગે જોતિયા, જીન
દેઇ દાન ઇમ એક વરસી.

મું ૩

ભાવાર્થ:—ધણુા દેશ-નગરને પત્તનોમાં (નગર
વિશેષમાં) ઉદ્ઘોષણા (જાહેર) કરીને શ્રી વીરસ્વામીએ
મિધની પેઠે દાનરૂપીજળધારુંવરસાંયું, તેમાં ધન સુવર્ણ
અને દેહિષ્યમાન જ્યોતિવાળાં મોાતી ઈત્યાદિ વસ્તુઓનું
શ્રી જુનેશ્વરે ૧. વર્ષ સુધી દાન આપ્યું. ॥ ૩ ॥

દોયવિણ તોય ઉપવાસ આડે કરી, માગસિર કૃષ્ણ
દર્શાપી દિહાડે; સિદ્ધિ સામ્હા થિ વીર દીક્ષા લેઇ, પાપ સંતાપ
મલ દૂર કાઢે.

મું ૪

ભાવાર્થ:—એટહું બધું દાન આપ્યા છતાં પણ શ્રી
વીર લગવાને રાગ દ્રેષ રહિતપણે ઉપવાસ વિગેરે તપ કરી
માગશર વદિ ૧૦ મીને દિવસે મોક્ષની સન્મુખ થઈ શ્રી
વીર લગવાને દીક્ષા અંગીકાર કરી પાપ રૂપી સંતાપ અને
કર્મરૂપી મેલ ફૂર કરવા માંથો. ॥ ૪ ॥

બહૂલ બંભણ ઘરે પારણું સાંપિએ, પુણ્ય પરમાન્ન મધ્યા નહ
કિધું; ભુવન ગુરુ પારણા પુન્યથી બંભણે, આપ અવતાર ફલ
સયલ લિધું.

મું ૫

ભાવાર્થ:—ત્યાં શ્રી વીર સ્વામીએ બહુત નામના

આદ્ધારુને ઘેર પુષ્ય વડે મધ્યાન્હ દિવસે ખીરનું ખારણું કર્યું, અને ત્રણું જગતના ગુરુને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુવ આદ્ધારું પોતાના જન્મનું સર્વ શુલ્ક ઇણ ઉપર્યાન કર્યું. ॥ ૫ ॥

કર્મચંડાલ ગોસાલ સંગમ સુરો, જીણે જીન ઉપરે ઘાત મંડયો; એવડો વયર તેં પાણિયા સેં કર્યો, કર્મ કોડિ તુંહિજ સબળ દંડયો.

સું ૬

ભાવાર્થ:—વળી કમે ચડાલ એવો જોશાળો અને સંગમ દેવ કે કેણે શ્રી લુનેશ્વરના ઉપર ઉપધાત. (ઉપ-સર્ગ) પ્રારંભ્યો હતો, તો હે પાપી જોશાળો અને સંગમ દેવ ! તેં ભગવાન સાથે એટલી બધી શત્રુવટ થા માટે ઈરી ? અને તેમ કરવાથી કરેડે. કર્મો વડે તમો પોતે જ ખરી રીતે હંડાયા છો ! ॥ ૬ ॥

સહજ ગુણ રોષિઓ નામે ચંડકોષિઓ, જીનપદે સ્વાન જિમ જેહ વિલગો; તેહને બુદ્ધિ ઉદ્દર્યો જગર્ણતિ, કિથલો પાપથી અતિહે અલગો.

સું ૭

ભાવાર્થ:—વળી સ્વભાવથી જ કુદ્ધ શુલ્કવણો ચંડ કોષિક નામે ભડા સર્વ કે જે લુનેશ્વરના ખજે શ્વાનની ચેઠે વળબ્યો હતો (કરડયો) તેને પણ હે લુનેશ્વર આપે એદ્ધ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો ॥ ૭ ॥

વેદયામા ત્રિયામ લગે સેદિયો, મેદિયો તુલ્લ નવિ ધ્યાન કુંભો; શૂલપાણિ અનાણિ અહો બુદ્ધબ્યો, તુલ્લ કુંભ પાર પારે ન સંભો.

સું ૮

ભાવાર્થ:—વળી શુલપાણી યક્ષ તમને કદરથંના કર-
વામાં રાત્રિના ઉ પ્રહુર સુધી પરિશ્રમ કરી થાક્યો પણ
તમારો ધ્યાનનું ધોણે લેદાયો નહિં, અને અહો તે અજાની
શુલપાણી યક્ષને ઉલટો બોધ પમાડ્યો માટે તમારી દ્યાનો
પાર તો મહાદેવ સરખા પણ પામે નહિં. ॥ ૮ ॥

સંગમે પિડીઓ પ્રભુ સજલ લોયણે, ચિત્વે લુટશ્યે કિમ
એ હો; તાસ ઉપરે દ્યા એવડિ શી કરી, સાપરાધે જને સબરું
નેહો..

મું ૯

ભાવાર્થ:—સંગમ હેવે જ્યારે અત્યંત હુઃખ આપવા
માંડયું ત્યારે ભગવાન આંસુ સહિત લોચન વડે ચિંતવવા
લાગ્યા કે અહો આ બિચારો જીવ શી રીતે બોધ પામશો?
તો હે પ્રભુ ! અપરાધી જન ઉપર એટલો બધો પ્રથળ
રનેક શા માટે ? ॥ ૯ ॥

ઇમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વરસ, સાર્દી ઉપર અધિક
પદ્ધતિ એકે; વીર કેવલ લહું કર્મ દુખ સવિ દહું, ગહગહું સુર
કરનિ નર અનેકે.

મું ૧૦

ભાવાર્થ:—એ પ્રમાણે અનેક ઉપસર્ગ સહન કરતાં
સૂર્ય જેટલાં (૧૨) વર્ષને ઉપરાન્ત ૦॥ વર્ષને એક પખ-
વાડીયું (૧૨॥ વર્ષને ૧૫ દિવસ) વ્યતીત થયે શ્રી
વીર ભગવાન કેવલજ્ઞાન પાણ્યા અને સર્વ ધાતિ કર્મનું
હુઃખ બાળ્યાં, અને હેવનો સમૂહ તથા અનેક મનુષ્યો અતિ
હુખ્યાં પાણ્યા. ॥ ૧૦ ॥

દ્રદ્રભૂતિ પ્રમુખ સહસ ચउદશ મુનિ, સાહુણી સહસ છ્રીસ

विहसी; ओगणसठ सहस एक लाख श्रद्धालुआ, आविका
त्रिलख अठार सहसी. मु० ११

भावार्थः—त्यारभाद गौतम प्रभुभ १४००० मुनि,
निर्माणी अवी ३६००० साध्वी १५६००० श्रावक ने
३१८००० श्राविका ईत्यादि श्री वीर स्वामीना परिवार
थयेा. ॥ ११ ॥

इम अखिल साधु परीवारशं परवरचो, जलधि ऊंगम
जीश्यो गुहिर गाजे; विचरता देश परदेश निय देशना, उप-
दिशे सयल संदेह भांजे. मु० १२.

भावार्थः—अे प्रभाषे सर्व साधुओना परिवारे
परिवरेता, ऊंगम समुद्रनी भाइड गर्जना करता, अने
देश परदेशमां विहार करता श्री वीर लगवान पोतानी
देशना वडे उपदेश आपता छता सर्व लुवोना खंशय दूर
करे छे ॥ १२ ॥

३८ भीज.

विवाहलानी देशी.

हवे नियाय अंतीम समे, जाणिय श्री जिनरायरे;
नयरी अपापाए आवीशा, राय समाजने ठायरे.
इम्तिपालगराये दीठला, आवियडा ऊंगण बाररे;
नयण कमल दोय विहसीआ, हरसीला हङडा मङ्गारे. १३
भावार्थः—हवे श्री लनेश्वर पोताना आयुर्यनो

अन्त्य समय राणी अपापा नगरीमां राज्यशाणाने स्थाने
पधार्यां ते वर्खते हस्ति पाण राज्ये पेताना आंगणाने
द्वारे आवेला हेडी राजनां घन्ने नयन कमण प्रकृष्टित
थयां अने हुद्यमां धल्णे। ૬૫ पाठ्या. ॥ १ ॥

भले भले प्रभुजी पधारीया, नयन पावन किधां रे;
जनम सफल आज अम तणो, अम्ह घरे पाउलां दीधांरे.
राणी राय जिन प्रणर्माया, मोटे मोतियडे वधाविरे;
जिन सनमुख कर जोडीय, बेठला आगले आविरे. ૧૪

लावार्थः—હे प्रभु ! आप लक्षे लक्षे पधार्यां, अमारां
नेत्र आज पवीत्र कीधां, अने अमारे। जन्म पाणु आजे
सङ्ग थयें। के अमारे घेर आपनां पगलां थयां ए प्रभणे।
लावना लावी राजा अने राणी घन्नेऽये नमस्कार करीने
प्रोष्ट मैती वडे वधाव्या, अने छुनेश्वर सनमुख हुथ
बेडी आजण आवीने षेठा. ॥ २ ॥

धन अवतार अमारडो, धन दिन आजुनो एहोरे;
सुश्तरु आंगणे मोरिओ, मोतियडे वृटलो मेहोरे;
आळयु अमारडे एवडो, पूरव पुन्यनो नेहोरे;
हैडलो हेजे हरसिओ, जो जिन मलिओ सजोगोरे. ૧૫

लावार्थः—હे प्रभु ! अमारे अवतार धन्य छे,
आजुनो आ हिवस धन्य छे, अमारे आंगणे कृष्णवृक्ष
इव्यें, मैतीऐ मेहु वरस्या, अहो अमारे आटलो अधेट
भूर्व पुन्यनो संबंध के अमने श्री छुनेश्वरनो संलेग
भव्यें। ॥ ३ ॥

अति आदर अवधारिण, चरम चोमासलु रहियारे;
 राय राणी सुरनर सवे, हियडला मांहे गहा हियारे.
 अमृतथी अति मीठडी, सांभली देशना जिननीरे;
 पाप संताप परो थयो, शाता थइ तन मननोरे. १६

लावार्थः—श्री लुनेश्वर पण्डि राजने अत्यंत अद्वितीय लाखीने छेव्हुं येमासुं अपापापुरीमां रह्या, तेथी राजा राणी देव अने भनुष्य सर्वे पेताना हुद्यमां हुर्ष पाम्या हुवे त्यां अमृतथी पण्डि अत्यंत भधुर एवी श्री लुनेश्वरनी वाणी सांभलीने सर्वनां पाप अने संताप द्वर थया अने शरीरने तथा भनने धाणी शाता उत्पन्न थर्ज ॥ ४ ॥

इंद्र आवे आवे चंद्रमा, आवे नरनारीना वृंदरे;
 त्रिण प्रदक्षणा देइ करी, नाटिक नव नवे छंदोरे;
 जिनमुख वयणना गोठडी, तिहां होये अति घणा मीठीरे;
 ते नर तेहज वरणवे, जीणे निज नयणले दीठीरे. १७

लावार्थः—त्यां अपापापुरीमां श्री वीरलुनेश्वरने वंदन करवा भाटे ईन्द्र आवे छे, चन्द्रःहि आवे छे, अने खो पुढेना समुद्राय आवे छे, तेच्चो त्रिय प्रदक्षिणा हुर्जने नवा नवा छंद (=गायन) पूर्वक नाटा रंग करे छे अने त्यां लुनेश्वरना मुखना वयननी वातो ते धाणी ज मीठी लागे छे. अने ते वयननी वात तो तेज भनुष्य वर्णवी शके के जेण्हे पेतानी नजरे हेझी छेय (=साक्षात् सांभली छेय तेज लगवाननी वाणीनी मीठाश लाणी शके.) ॥५॥

इम आणंदे अतिकम्या, श्रावण भाद्रवो आसोरे;
 कौतिक कोडिलो अनुक्रमे, आवियडो कार्तिक मासोरे.

पाखि पर्व पन्होतलुं, पोहतलुं पुन्य प्रवाहिरे;
राय अढार तिहां मिल्या, पोसह लेवा उछांहिरे. १८

भावार्थ——એ પ્રમાણે અતિ આનંદ પૂર્વક શ્રावણ—
ભાડપદ—ને આસે ભાસ તો વ્યતીત થયો ને હુવે અનુ-
ક્રમે કૈતુકવાળો ને કૈકીલો એવો કાર્તિક ભાસ આવ્યો,
ને પને!તું તથા પુન્યના પ્રવાહલાળું એવું પાલિક પર્વ
પણ આવી પહોંચ્યું, તે વખતે ઉત્સાહ પૂર્વક પૌષ્ઠ વ્રત
શહણ કરવા માટે ત્યાં १८ રાજાઓ આવી મદ્યા॥૬॥
ત્રીમોવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામોરે;
સહેજ સંકિરણ તિહાં થયો, તિલ પડવા નહિ ટાંમોરે.
ગોયમ સ્વામિ સપોવડી, સ્વામિ સુધર્મા તિહાં બેઠારે;
ધન ધન તે જિણે આપણે, લોયણે જિનવર દિઠારે. १९

ભાવાર્થ——તથા શ્રી જ્ઞનેશ્વરને વંદના કરવા માટે
ગ્રણે ભુવનના અનેક જન સમુદ્દર ત્યાં આવી મદ્યા, તેથી
ત્યાં સ્વાભાવિક રીતે એટલી ખધી સંકઢાશ થઈ કે એક
તલનો દાણો પડવા જેટલું પણ સ્થાન ખાડી રહ્યું નહિં,
ત્યાં જૈતમસ્વારી સરખા શ્રી સુધર્મા સ્વામિ (ચોસહ
ઉચ્ચરાવવા એઠા, અહો આપણા સર્વમાં તેઓને ધન્ય છે
કે જેણે શ્રી જ્ઞનેશ્વરને સાક્ષાત् નજરથી દેખ્યા હશે) ॥૭॥
પૂરણ પુન્યના ઓપથ, પોષથ વ્રત વેગે લિધાંરે;
કાર્તિક કાલી ચउદશો, જિન મુખે પચખાણ કિધાંરે.
રાય અડાર પ્રમુખ ઘર્ણે, જિન પગે વાંદળાં દિધાંરે;
જીન વચનામૃત તિહાં ઘર્ણે, ભવિયણે ઘટ ઘટ પીધાંરે. २०

ભાવાર્થ—હવે ૧૮ રાજાઓએ સંપૂર્ણ પુન્યના ઐષધરૂપ પોસહ પ્રતિ શિશ્વ લીધું અને કાતિંક વહિ ચતુર્દશીને હિવસે (=ગુજરાતી આસો વહિ ૧૪ ને હિવસે) શ્રી જીનેશ્વરને સુખે પોસહનાં પચ્ચાણુ ઉચ્ચર્યાં, તથા ૧૯ રાજ વિગેરે ધણ્ણા જન સમૃદ્ધાયે શ્રી જીનેશ્વરને ચરણુકમણે ચાંદણ્ણાં દીધાં, ને ત્યારભાદ ત્યાં ધણ્ણા સંબ્ય જીનોચે શ્રી જીનેશ્વરના વચ્ચન ઇપી અમૃતને ધુંટડે ધુંટડે પીધું (=અંશીત શ્રી જીનેશ્વરની દેશના સાંભળ.)) ॥ ૮ ॥

ઢાલ ઉ ૩.

॥ રાગ ભારુ ॥.

શ્રી જગદીશ દ્વારા દુખ દૂર કરે, કૃપા કાંડિ તુજ જોડી; ૨૧
જગમારે જગમારે કહિએ કેહને વીરજારે.

ભાવાર્થ—હે શ્રી જગતના ઈશ્વર હે દ્વારુ જેણે
તારી હોડ કૃપા મેળવો છે તે પોતાનાં હુઃખ ફૂર કરે છે,
હવે જગતમાં હે વીર ! હે વીર ! એમ કેને કહીએ !॥ ૧ ॥

જગ જનને કુગ દેશે એહવી દેશનારે, જાળિ નિજ નિરવાણ;
નવ રસરે નવ રસરે સોલ પહોર દિયે દેશનારે. ૨૨

ભાવાર્થ—હે પ્રભુ પોતાને નિર્વાણ સમય નાણક
જાણી જગતના જીવેને આવી દેશના કેણુ આપશે ? હે
પ્રભુ ! આપે તો નવ રસ યુક્ત દેશના ૧૬ પ્રહર સુધી
દીધી છે. ॥ ૨ ॥

प्रबल पुन्य फल संसुचक सोहामणारे, अङ्गयणां पण पन्न;
कहियांरे कहियांरे महियां सुखं सांभलि होएरे. २३

लावार्थ—ते देशनाभां प्रभल पुन्यना झणे सू-
चवनारां ने शोभीतां पप अध्ययन कह्यां के जे सांलग्नीने
पृथिव्मां सर्वं ज्ञेने सुख उत्पन्न थाय ॥ ३ ॥

प्रबल पाप फल अङ्गयणां तिम तेटलांरे, अण पुछयां छत्रीस;
सुणतांरे सुणतांरे भणतां सविसुख संपजेरे. २४

लावार्थ—पुनःदेशनाभां प्रभल ऐवा पापना झण-
वाणां पण तेटलांज अध्ययन कह्यां ने नहिं पूछेलां ऐवां
उ६ अध्ययनो कह्यां ते सांलग्नां सर्वं ज्ञेने सुख
उत्पन्न थाय छे ॥ ४ ॥

पुण्यपाल राजा तिहां धर्म कथांतरेरे, कहो प्रभु प्रतक्ष देव;
मुजनेर (२) सुपन अर्थ सवि साचलोरे. २५

लावार्थ—हुवे त्यां धर्मकथानी वयमां पुण्यपाल
राजाए कह्युं के हे प्रभु ! हे प्रत्यक्ष हेव ! मने जे स्वम.
आ०यां छे तेनो सत्य अर्थ कहो ॥ ५ ॥

१ २ ३ ४ ५ ६ ७ ८
गज वानर खीर दुम वायस सिंह घडोरे, कपलबीज इम आठ;
देखिरं (२) सुपन सभय मुझ मन हुओरे. २६

लावार्थ—हस्ति-दानर-क्षीर-वृक्ष-काग-सिंह-धडो
ने कमण्ठुं भीज ए आठ स्वम हेखीने भाद्रं मन लय
भ्रान्त थयुं छे ॥ ६ ॥

ઉખર બિજ કપલ અસ્થાંનકે સિંહનુરે, જીવ રહિત શરીર;
સોવનરેકુંભ મળિન એ શું ઘટેરે.

૨૭.

ભાવાર્થ—પુનઃ એ સ્વભ્નોમાં ઉખર ક્ષેત્ર (=ખાર ભૂમિ) દ્વારા અસ્થાન કે કમળનું ખીજ (ઉગેલું) દેખ્યું, અને સિંહનું જીવરહિત શરીર દેખ્યું, અને સોનાનો ઘડો પણ મર્દિન દેખ્યો તો તેનો અર્થ શું ઘટે છે તે કૃપા કરી કહો. ॥ ૭ ॥

વીર ભણે ભૂપાલ સુણો મન થીર કરીરે, સુંપિણ અર્થ સુવિચાર;
હૈડે રે (૨) ધરજ્યો ધર્મ ધુરંધરુરે. ૨૮

ભાવાર્થ—ત્યારે શ્રી વીર સ્વામિએ કણ્ઠનું કે હે રાજા ચિત્ત સ્થિર કરીને સાંલણો અને તે અર્થ સાંલળી હૃદયમાં ધુરંધર એવો ધર્મ ધારણુ કરને (પણ નકામો વિધાદ કરશો નહિં). ॥ ૮ ॥

ઢાલ ૪ થી.

શ્રાવક સિંહુર સારિખા, જીન મતના રાગી,
ત્યાગી સહ ગુરુ દેવર્ધ્મ, તત્વે મતિ જાગિ;
વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પુરા,
એહવા શ્રાવક હોયસે, મર્તિમંત સનુરા.

૨૯.

ભાવાર્થ—હુદે આ ઢાલમાં પુષ્યપાલ રાજુએ પૂછેલા સ્વભ્નનો અર્થ શ્રી વીર લગવાન કહે છે કે હે પુષ્યપાલ રાજ ! જૈનધર્મના રાગી એવા શ્રાવકો તે હસ્તિ

સરખા જાણુવા, તેઓ બત પ્રત્યાખ્યાન વાળા તથા દેવ
ગુરુ ધર્મ રૂપ તત્ત્વપર જેની ભતિ જાગૃત થઈ છે એવા,
પુનઃ વિનય વિવેકને વિચારવાળાને જૈનશાસનના ગુણુમાં
ફૂરા, એવા ભતિમાન ને તેજવાન આવકો થશે ॥ ૧ ॥

લાલચે લાગા થોડિલેં, સુર્ખ રાચિ રહિયા,
ઘરવાસે આશા અમર, પરમારથ દૂહિયા
બ્રત વયરાગ થકિ નહિ, કોઇ લેશે પ્રાયે,
ગજ સુપને ફલ એહ, નેહ નવિ માંહોમાંહે. ૩૦

ભાવાર્થ—તે આવકો થોડા લોકભાં વળગી રહીને
સુખભાં રાચી રહેશે, ને લુંધગી સુધી ગૃહવાસભાં રહેવાની
કુદ્ધાવાળાને પરમાર્થભાં દુખીયા (=પરમાર્થ વિશેષ નહિં
કરવાવાળા) તથા કે આવકોમાથી વૈરાગ્ય પામીને પ્રાય:
કેદીકજ ચારિત્ર અંગીકાર કરશે (બાકી ધણુખરા દુઃખના
નિમિત્તે ચારિત્ર લેશે) અને માંહોમાંહે સ્નેહ પણ નહિં
એવું કુળ હસ્તિના સ્વર્જનંતું જાણું. ॥ ૨ ॥

વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોગ,
આગલ હોસ્યે લાલચિ, લોભી મન ખોટા;
આચારજ તે આચારહિણ, પ્રાયે પરમાદિ,
ધર્મ મેદ કરસ્યે ઘણા, સહજે સ્વારથ વાર્દી. ૩૧

ભાવાર્થ—વાનર જેમ ચંચળ અને ચપળ સ્વભાવી
છે, તેમ તેના સરખા મોટા મુનીએ પણ આગળ ચંચળને
ચપળ સ્વભાવી થશે, તેમજ લાલચુ લોભી અને મોટા મન-

વાગા થશે. તથા આચાર્યો તે આચારવિનાના ને પ્રાય: પ્રમાણી
થશે, ધર્મમાં ધણ્ણા લેદ પાડશે, અને સહજ વાતમાં સ્વા-
ર્થનું એલનાર થશે, ॥ ૩ ॥

કો ગુણવંત મહેત સંત, મોહન મુનિ રૂડા;

મુખ પીઠા માયાવિયા, મનમાંહે કુડા.

કરસ્યે માંહોમાંહે વાદ, પર વાદેં નાસે;

બીજા સુપન તણો વિવાર, ઇંમ વીર પ્રકાશે. ૩૨

ભાવાર્થ—તથા કોઈકજ મુનિ ગુણવંત મહાત્મા સંત
જગતને મોહ પ્રમાણનાર એવા ભલા મુનિ થશે, બાકી
ધણ્ણા ખરા તો મુખે મિષ્ટ એલનારા હૃદયમાં પ્રપદ્યવાળા
ને મનમાં એટા એવા તે મુનિએ માંહેમાંહે વાદ વિવાદ
કરશે, અને અન્યદથનીના વાદ સમયે નાસી જશે એ
પ્રમાણે ધીજ સ્વર્ણનો વિવાર શ્રી વીરસ્વામિએ પ્રગટ
કરુંયે। ॥ ૪ ॥

કલ્પવૃક્ષ સરિખા હોસ્યે, દાતાર ભલેરા;

દેવ ધર્મ ગુરુ વાસના, વરિ વારિના વેરા:

સરલ વૃક્ષ સવિને દીંયે મનમાં ગહગહતા,

દાતા દુરલભ વૃક્ષ, રાજ ફલ ફુલે ત્રહતા. ૩૩

ભાવાર્થ—ભલા એવા દાતાર પુરુષો કલ્પવૃક્ષ સરખા
થશે, તેએ દેવ ગુરુ ધર્મની વાસનાવાળા ઉત્તમ જણના
પ્રવાહ સરખાને સરળ વૃક્ષની પેઠે સર્વને દાન દેવાથી મ-
નમાં હુર્ધુર પામતા એવા હુર્દુભ દાતાર ૩૫ વૃક્ષરાજ (=ક-
લ્પવૃક્ષ) ક્રણ અને કુલના ભારવડે નમી જનારા થશે। ૫ ॥

કપટી જિનમતલિંગિયા, વળી બબુલ સારિખવા,
ર્હીંર વૃક્ષ આડા થયા, જીમ કંટક તિખા;
દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી,
ત્રિજા સુપન વિચાર કહ્યો, જિન ધર્મ વિધાત્રી. ૩૪

ભાવાર્થ—વળી કપટી એવા જૈનમુનિના વેષને ધારણું
કરનારા તે ભાવળ સરખા થશે, અને કાંટા વડે તીક્ષ્ણ
એવાં ક્ષીર વૃક્ષ જેમ આડાં થયાં તેમ પવિત્ર પાત્રને હાન
હેતાં પણ ખીલ નિવારણ કરશે, એ પ્રમાણે જૈનધર્મના
નાયક શ્રી વીરલુનેશ્વરે ખીલ સ્વખને અર્થ કહુયો ॥૬॥

સિહ કલેવર સારિખો, જિનશાસન સબલો,
અતિ દુર્દાંત અગાહનિય, જિનવાયક જમલો;
પરશાસન સાવજ અજ, તે દેરવી કંપે,
ચઉથા સુપન વિચાર ઇમ, જિનમુખથી જંપે. ૩૫

ભાવાર્થ—સખળ એવું જૈનશાસન તે સિંહના ખ્લેવર
સરખું છે, કારણ કે જૈન સિદ્ધાંત અતિ હુડીન્ત (=ખીલે
કોઈ ન દ્યાખી શકે એવું) ખીલથી અવગાહન ન થઈ
શકે (=સમ્યક્ સ્વરૂપ ન સંમળય) એવું જરૂરે છે, છતાં
પણ અન્યદર્શન રૂપી સાવજથી બકરાની માર્ગકે કંપાયમાન
થશે, એ પ્રમાણે શ્રી વીરલુનેશ્વરે પોતાના મુખથી ચોથા
સ્વખને અર્થ કહુયો ॥ ૭ ॥

ગચ્છ ગંગાજલ સારીખો, મૂકી મતિ હિણા,
ગુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ દીણા.

વंचक આચારજ અનેક, તિણે ભુલવિયા;
તે ધર્માતર આદરે, જડમતિ બહુ ભવિયાં.

૩૬

ભાવાર્થ—ગગાળ સરખો પોતાનો ગચ્છ (શુદ્ધકુ-
લવાસ) સુકીને મહિલાન એવા મુનિઓનું મન હીન અ-
ગડાયો જેમ ખાણેચીયાંમાં આનંદ પામે તેમ એકલ વિ-
હારમાં આનંદ પામશે. વળી અનેક જે પ્રપંચી આચારો
થશે તેઓએ બુલાવેલા ધખુા જડમતિવાળા ક્ષવ્ય જુવે
ઓના ધર્મનો આદર કરશે ॥ ૮ ॥

પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાને;
છઠે સાંવન કુંભ દીઠ, મઝલો સુણ કાંને.
કો કો મુનિ દરસણ ચારિત્ર, મ્યાન પૂરણ દેહા;
પાલે પંવાચાર ચારુ, છંડિ નિજ ગેહા.

૩૭

ભાવાર્થ—એ પ્રમાણે પાંચમા સ્વખનો અર્થ રાબને
સંભળાવ્યો હવે છુટે સ્વખને સુવર્ણનો ધકે મહિન દેખશે
તેનો અર્થ સાંભળ ! કેાઈ કેાઈ મુન પોતાના ધર કુદુંબનો
ત્યાગ કરી દર્શન-શાન-ને ચરિત્ર વડે પરિપૂર્ણ દેહાળા
થઈ મનોહર પાંચ પ્રકારનો આચાર પાળશે ॥ ૯ ॥

કો છપટી ચારિત્ર વેષ, લેઝ વિશ્વતારે;
મઝલો સોવન કુંભ જીમ, પિંડ પાપે ભારે.
છઠા સુપન વિચાર એહ, સાતમે ઇંદિવર;
ઉકરઢે ઉતપત્તિ થઈ, તે શું કહો જિણવર.

૩૮

ભાવાર્થ—અને કેટલાક કૃપટીઓ ચારિત્રનો વેષ

ધારણુ કરી ખીજને ઠગશે અને જેમ સુવર્ણનો ધંડો મેલેટા
દેખ્યો તેમ પાપ વડે પોતાનું ઉદ્દર ભરશે એ છઢુા સ્વ-
અન્નો અર્થ કહ્યો. હવે સાતમે સ્વર્ણે જે ઉકરામાં કમળ
ઉગેલું દેખ્યું તેનો શું અર્થ ? તે હે જુનેથ્યર આપ પ્રકાશ
કરો, ત્યારે શ્રીવીર જુનેથ્યર કહે છે કે ॥ ૧૦ ॥

પુણ્યવંત પ્રાણિ હુસ્યે, પ્રાહિં મધ્યમ જાતિ;
દાતા ભાંક્તા ક્રદ્ધિવંત, નિરમલ અવદાત.
સાધુ અસાધુ જતિ વદે, તત્ત્વ સરીખા કિજે;
તે બહુ ભદ્રક ભવિયણે, સ્યો ઉલંભો દીજે. ૩૯

ભાવાર્થ:—પ્રાયઃ મધ્યમ જલતિના જુવે ધણ્ણા પુન્ય-
વંત થશે, તેઓ દ્વાતા—સોક્તા—ક્રદ્ધિવાન—ને નિર્મિત ચરિત્ર
વાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા
ગણુંને ધણ્ણા ભદ્રિક ભન્યો વંદના નમસ્કાર કરશે તે સર્વને
શું ઉપાલંભ (=૬૫કો) અપાય ! ॥ ૧૧ ॥

રાજા મંત્રિપરે સુ સાધુ, આપોષું ગોપી;
ચારિત્ર સુધુ રાખસ્યે, સર્વિ પાપ વિલોપી.
સમુપન વિચારવીર, જિનવરે ઇમ કહિયો;
અઠમ સુપન તણો વિચાર, સુંણિ મન ગહગહિઓ. ૪૦

ભાવાર્થ:—જાણું જેઠને ગાંડા થયેલા રાજુ અને
અધાનની માઝું સુસાધુએ પોતાનો ભાવ જોપવી અને
સર્વ પાપનો નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે
શ્રીવીરજુનેથ્યરે સાતમા સ્વર્ણનો અર્થ કહ્યો, અને હવે

આડમા સ્વર્ણનો અર્થ સાંકળી રાજ પોતાના મનમાં અતિ
હું પામ્યો ॥ ૧૨ ॥

ન લહે જિન મત માત્ર જેહ, તેહ પાત્ર ન કહિએ;
દિથાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે.
પાત્ર અપાત્ર વિચાર મેદ, ખોલા નવિ લહેસ્યે;
પુણ્ય અર્થે તે અર્થ, આથ કુપાત્રે દેહસ્યે. ૪૧

ભાવાર્થો—તે આડમા સ્વર્ણનો અર્થો આ પ્રમાણે—
નેચો જૈનધર્મ માત્રને પણ પામ્યા નથી તેચો પાત્ર ન
કહેવાય, અને તેચોને દાન આપવાથી પરસવનું પુન્યકૃત
કંઈ પણ પ્રાપ્ત થાય નહિં. એ પ્રમાણે પાત્ર અપાત્રનો
વિચાર લદ્રિક જુવો સમજશે નહિં, અને કુપાત્રને પણ
પુણ્ય થશે એમ ધારી ધન લક્ષ્મી વિગેરેનું દાન આ-
પશે. ॥ ૧૩ ॥

ઉત્તર ખૂબિ દૃષ્ટિ વિજ, તેહનો ફલ કહિએ;
અણુમ સુપન વિચાર ઇંમ, રાજા મન ગ્રહિયે.
એ અનાગત સવિ સરૂપ, જાણિ તિણે કાલે;
દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્ય પાલે. ૪૨

ભાવાર્થ—એ ઉત્તર ખૂબિમાં હેઠેલું (=ઉગેલું) જે
ખીજ તેનું કૃત કહેવાય. એ પ્રમાણે આડમા સ્વર્ણનો અર્થ
હું રાજુન ! તારા મનમાં જાણુનો. અહો ! આ ભગવાન
શવિષ્યકાળનું પણ કેવું સત્ય સ્વરૂપ જાણે છે ! એમ જાણી
પુન્યપાલ રાજાએ તેજ વખતે શ્રીવીરભગવાનની પાસે દીક્ષા
અંગીકાર કરી. ॥ ૧૪ ॥

॥ ઢાક પ્ર ભી. રાગ ગોડિ ॥

ઇંદ્રભૂતિ અવસર લહિરે, પુછે કહો જિનરાય;
સ્યું આગળ હવે હોયસ્યેરે, તારણ તરણ જીહાજો રે.
કહે જીન વીરજી.

૪૩

ભાવાર્થ—હવે શ્રી ગૈતમસ્વામી અવસર પામીને શ્રી વીરને પૂછે છે કે હે લુનેશ્વર ! હે સંસાર સમુદ્રથી તારવાને અને તરવાને ૦હાણું સમાન શ્રી વીર લુનેશ્વર ! હવે આગળના કાળમાં શું શું થશે ? તે કૃપા કરીને કહો. ॥૧॥

મુજ નિરવાણ સમય થકીરે, ત્રિહૂ વરસે નવ માસ;
માઠરો તિહાં બેસક્ષયેરે, પંચમ કાલ નિરાસોરે. કહે ૦ ૪૪

ભાવાર્થ—ત્યારે શ્રી વીર લુનેશ્વર કહે છે કે હે ગૈતમ ! મારા નિર્વાણના સમયથી ત્રણું વર્ષને નવમાસે ધણ્ણું માઠો અને નિરાસ (=ઉદાસીન કરનારો) એવો પાંચમેં આરો બેસક્ષયે ॥ ૨ ॥

ચારે વરશ્યે મુજ થકિરે, ગૌતમ તુજ નિરવાંણ;
સોહમ વીશે પામશેરે, વરસે અખય સુખ ઠાંણોરે. કહે ૦ ૪૫

ભાવાર્થ—મારા નિર્વાણથી ૧૨ વર્ષો હે ગૈતમ ! તું મોદ્દે જઈશ. અને સુધમો ગણુધર ૨૦ વર્ષો અક્ષય સુખ ૩૫ મોક્ષ સ્થાન પામશે ॥ ૩ ॥

ચંડસઠ વરસે મુજ થકિરે, જંબૂને નિરવાણ;
આથમસે આદિત્ય થકિરે, અધિકું કેવલ નાંણો રે. કહે ૦ ૪૬

ભાવાર્થ:—મારા નિર્વાણથી ૬૪ વર્ષો જંખુસ્વામિ

મોશે જથે અને સૂર્યથી પણ અધિક પ્રકાશ કરતાર કેવ-
જાન અસ્ત પામશે (=વિચ્છેદ જથે) ॥ ૪ ૫

મન પજ્વ પરમાવધિરે, ક્ષપકોપશમ મન આંણ;
સંયમ ત્રિણ જિન કલનીરે, પુલાગાહારગહાંણ રે. કહે૦ ૪૭

ભાવાર્થ—પુતઃ મન: પર્યવસાન=પરમાવધિજાન-
ક્ષપકશેખુ-ઉપશમ શેખુ-પરિહારવિશુદ્ધિ-સૂક્ષમસ્તંપરાથ-ને
યથાખ્યાતએ ઉ ચારિત્ર-જીતકણ્ણ-પુલાકલખિંધિ-ને આહારક
લખિંધિ એટલી વસ્તુઓ વિચ્છેદ પામશે એમ બણું ॥૪૭॥
સિજ્જંભવ અઠાંણવેરે, કરસ્યે દસ (વૈ) આલિય;
ચતુ પૂર્વિ ભદ્ર બાહ્યીરે, થાસ્યે સયલ વિલિઓરે. કહે૦ ૪૮

ભાવાર્થ—મારા નિર્વાણથી ૬૮ વખે શ્રી શાખાલ-
વસૂરિ દશવૈકાલિક નામતું સૂત્ર રચશે, અને ચૈદ પૂર્વીં
શ્રી લદ્રભાડુ સ્વામિથી ચાર પૂર્વને અર્થ વિચ્છેદ જથે
(=લદ્રભાડુ સ્વામિ સુધી ૧૪ પૂર્વને અર્થ રહેશે અને
ત્યારબાદ ૧૦ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ ચૂણ
રહેશે.) અથવા શ્રી લદ્રભાડુ સ્વામિથી સંપૂર્ણ શ્રુતજ્ઞા-
નનો વિનાશ થશે. ॥ ૬ ॥

દોયશત પનરે મુજા થકિરે, પ્રથમ સંઘયણ સંઠાણ;
પૂર્વણુંગતે નવિ હૂસ્યે, મહાપ્રાણ નવિ ઝાંણોરે. કહે૦ ૪૯

ભાવાર્થ—મારા નિર્વાણથી ૨૧૫ વખે પ્રથમ સંઘ-
યણ અને પ્રથમ સંસ્થાન (=રજ્યાંસનારાચ સંખયણને સં-
મચતુરસ્ત સંસ્થાન) તથા મહા પ્રાણ નામતું ધ્યાન પ્રથમ
પ્રહરના પ્રારંભે વિચ્છેદ પામશે. ॥૩॥

चउत्रयपने मुझ थकिरे, होस्ये कालिक सूर;
करस्ये चउथी पजुसगेरे, वरगुण रयणनो पूरोरे. कहे० ५०

भावार्थः—मारा निर्वाणुथी ४५३ वर्षे श्री कालि-
आचार्य थशे ते उत्तम शुषु रत्ननो अंडार आचार्य चे-
थनां पञ्जुसणु (=संवत्सरी) करशे. ॥ ८ ॥

मुझथी पण चोराशियेरे, होस्ये वयर कुंमार;
दस पूर्वि अधिकालिओरे, रहस्ये तिहां निरधारोरे. कहे० ५१

भावार्थ—मारा निर्वाणुथी ४८४ वर्षे श्री बल-
कुमार नामना आचार्य थशे तेमनामां (अथवा त्यां सुधी)
कंधुक अधिक १० पूर्वनुं ज्ञान निश्चय रहेशे. ॥ ९ ॥

मुझ निर्वाण थकि छसेरे, विस पछी वनवास;
मुकी करसे नगरमारे, आर्य रक्षित मुनि वासोरे. कहे० ५२

भावार्थ—मारा निर्वाणुथी ६२० वर्षे पछी श्री
आर्य रक्षित सूरि वनवास भूडीने नगरमां वास करशे ॥ १० ॥

सहस्रे वरसें मुझ थकिरे, चउद पूर्व विच्छेद;
जोतिष अण मिलतां हूसेरे, बहूल मतांतर भेदोरे. कहे० ५३

भावार्थ—मारा निर्वाणुथी १००० वर्षे चाहे पूर्वनो
विच्छेद जशे, अने ज्येतिषनां गणित भराभर साचां नहिं
पडे, अने धणुा भतमतान्तर ने धणुा धर्मलेद थशे. ॥ ११ ॥

विक्रमथी पंच पंच्याशिएरे, होस्ये हरिभद्र सूरि;
जिन शासन अजुवालसेरे, जेहथी दूरियां सवि दूरोरे. कहे० ५४

भावार्थ—विक्रमथी ५८५ वर्षे श्रीहरिभद्र सूरि

થશે, તેઓ જૈન શાશનની શોભા વધારશે, અને જૈનાથી
સર્વ પાપો પણ દૂર રહેશે ॥ ૧૨ ॥

દ્વાદશ સત્ત સત્તર સમેરે, મુજથી મુનિ સુર હિર;
ચણ્યભટ્ટ સુરિ હોયસેરે, તે જિન શાસન વીરરે. કહેૠ ૫૫

ભાવાર્થ:—મારા નિર્વાણુથી ૧૨૭૭ વર્ષે શ્રી જૈન-
શાસનના વીર એવા શ્રી હીર સુરિ અને શ્રી બાપલટ્ટ
સુરિ થશે. ॥ ૧૩ ॥

મુજ પ્રતિર્વિબ ભરાવસ્યેરે, આંમરાય ભૂપાલ;
સાર્દ્દ ત્રિકોટી સોવન તણોરે, તાસ વયણથી વિશાળોરે. કહેૠ ૫૬

ભાવાર્થ:—શ્રી બાપલટ્ટ સુરિના વિશાળ ઉપદેશથી
આમ રાજ ભારી ડા. કે.ડ સુવણુંની પ્રતિમાઓ
ભરાવશે ॥ ૧૪ ॥

ઓડસ શત ઓગણોતરેરે, વરસે મુજથી મુર્ણિદ;
હેમસૂરિ ગુરુ હોયસ્યે રે, શાસન ગયણ દિંંદોરે. કહેૠ ૫૭

ભાવાર્થ:—મારા નિર્વાણુથી ૧૬૬૮ વર્ષે જૈનશા-
સનદ્ધી આકાશમાં સૂર્ય સમાન એવા અને સુનિઓમાં
ધિન્દ્રસમાન એવા હેમચંદ્ર ગાચાયાં થશે ॥ ૧૫ ॥

હેમસૂરિ પઢિબોહીસે રે, કુમારપાલ ભૂપાલ;
જીન મંડિત કરસ્યે મહીરે, જિન શાસન પ્રતિપાલોરે. કહેૠ ૫૮

ભાવાર્થ:—તે હેમચંદ્રાચાયાં કુમારપાળ રાજને પ્ર-
તિઓધ કરશે અને તે જૈનશાસનને પ્રતિપાલ કુમારપાલ
રાજ પૃથિવિને જૈન એત્યોથી શાખુગારશે ॥ ૧૬ ॥

ગૌતમ નવળા સમયથીરે, મુજ્જ શાસન મન મેલ;
માંહોમાંહે નવિ હોસ્યે રે, મચ્છ ગલાગલ કેલોરે. કહે૦ ૫૯

હે જૈતમ ! સમય નખળો હોવાથી ભારા શાસનમાં
મનનો મેલ વધશે, અને માંહોમાંહે મચ્છ ગલાગલની કી-
અનો ન્યાય થશે, (=મેટો મચ્છ જેમ નાના મચ્છને ગળી
બાય તેમ શાસનમાં જે જખરો થાય તે નખળાને દખા-
ણુમાં રાખે ને તુચ્છ ગણે ધર્યાદિ.) ॥ ૧૭ ॥

મુનિ મોટા માયાવિયારે, વેઢીગારા વિશેષ;
આપ સવારથ વસી થયારે, એ વિટંબક્ષે વેષોરે. કહે૦ ૬૦

ભાવાર્થ—મુનિએ ધણ્ણ માયાવીને વિશેષતાઃ વેઢી
ગારા (=કલેશ કરનારા) થશે અને પોતાના સ્વાર્થને વશ
થઈ મુનિ વેષને (વટંખણ્ણ પમાડશે. ॥ ૧૮ ॥

લોભિ લુખપતિ હોયસ્યેરે, જમ સરિખા ભૂપાલ;
સજન કિરોધિ જન હૂસેરે, નવિ લજ્જાલુ દયાલોરે. કહે૦ ૬૧

ભાવાર્થ—લક્ષાધિપતિએ તે લોકીયા થશે, રાજનો
તે જમ સરખા થશે, લોકો સજજનની સાથે વિરોધ ભાવ
રાખશે, તેમજ લાજ મર્યાદાવાળા કે દ્વારા નહિં
થાય ॥ ૧૯ ॥

નિરલાભિ નિરમાઝ્યારે, સુધા ચારિત્રવંત;
થોડા મુનિ મહિયલે હૂસેરે, સુણ ગૌતમ ગુણવંતરે. કહે૦ ૬૨

ભાવાર્થ—વળી હે ગુણવંત જૈતમ ! સાંભળ—હવે
આ પૃથિવમાં નિરોભી નિષ્કપ્તી ને શુદ્ધ ચારિત્રવાળા એવા
મુનિ થોડાજ થશે ॥ ૨૦ ॥

गुरुं भगति शिष्यं योडलारे, श्रावक भगति विहीण;
मात पिताना सुत नहीरे, ते महिलाना आधिनोरे. कहे० ६३

भावार्थ—पुनः गुरुं नी लक्षि उरनारा शिष्यं पछु
श्रावा थथे, श्रावकै लक्षि रहित थथे, पुत्रे। मातपिताना
नहिं रहे पछु खीने आधीन थथे ॥ २१ ॥

दुपसह सूरि फलगुसिरीरे, नायल श्रावक जांण;
सच्चसिरि तिम श्राविकारे, अंतिम संघ वखाण्योरे. कहे० ६४

भावार्थ—पुनः छेलामां छेला श्री हुपसह सूरि—
इन्द्रश्री साध्वी—नागिल श्रावकने सत्यश्री श्राविका ए
वतुर्विध संघ रह्यो छे ॥ २२ ॥

वरस सहस एकवीसतेरे, जिन श सन विख्यात;
अविवल धर्म चलावशेरे, गौतम आगम वातोरे. कहे० ६५

भावार्थ—हे जौतम (२१०००) वर्ष सुधी प्रख्यात
अवा जैन शासनमां धर्म अयल रहेशे ए प्रभाषे अवि-
धनी वातो छे ॥ २३ ॥

दूपमे दूपमा कालनीरे, ते कहिये शी वात;
कायर कंपे हैडलोरे, जे मुणतां अवदातोरे. कहे० ६६

भावार्थ—वणी हुषम हुषम नामना छहु आननी
तो वातज शुं कहेवी ! करण्यके जेनुं वृत्तांत सांखणतां
कायरनां तो हुष्यज कंपी उठे छे ॥ २४ ॥

દાલ ૬ હૃ.

પિણડો ભરે આવે, એ દેશી.

મુજસું અવિહડ નેહ બાંધ્યો, હેજ હૈડા રંગે;
 દુદ મોહ બંધણ સવલ બાંધ્યો, વજૂ જિમ અંધંગ;
 અલગા થયા મુજ થકિ એહને, ઉપજસેરે કેવલ નિય અંગકે;
 ગૌતમરે ગુણવંતા. ૬૭

ભાવાર્થ—ગૈતમસ્ત્વામિ કહે છે કે શ્રી વીર ભગવાન સાથે મારે દુદ રનેહ અંધાચો, ને હૃદય રંગાધ જવા પૂર્વક મને હથું ઉપજતો, ને દુદ એવા મોહના અંધન વહે હું વળની ચેઠે લેદ ન પામે તેવી રીતે અત્યંત અંધાચો તો પણ એ શ્રી વીર ભગવાન મને કેવળ જ્ઞાન ઉપજશે એમ ધારી મારથી અલગા થયા એ પ્રમાણે પ્રશસ્તરાગથી વિલાપ કરતા એવા ગુણવંત ગૈતમ સ્વામિ જ્યવંત વર્તો ॥ ૧ ॥

અવસર જાળિ જિનવરે, પુછિયા ગોયમ સ્વાંમ;
 દોહગ દુખિયા જીવને, આવિષે આપણ કામ.
 દેવ સર્મા બંધણો, જઇ બુજવોરે ઓણે ઢુંકડે ગાંમકે. ગૌ૦ ૬૮

ભાવાર્થ—શ્રી વીર ભગવાને ચેતાને નિર્વાણુ સમય જાણીને શ્રી ગૈતમ સ્વામિને કહું કે આપણે હુલ્લાંયવાળા અને હુઃખી જીવને ઉપકાર કરવાના કામમાં આવવું જોઈએ માટે અહિં નજીકના ગામમાં જઈ દેવશર્મી નામના આદ્ધાણુને પ્રતિષેધ આપો ॥ ૨ ॥

सांभली वयण जिणंदनुं, आणंद अंग न माय;
 गौतम बे कर जोडि, प्रणम्या विर जिनना पाय.
 पांगरथा पुरव प्रीतथी, चउनांणिरे मनमां निरमायके. गौ०६९

लावार्थ--ऐ प्रभाषे श्री वीर लुनेश्वरनुं वयन सांलणीने श्री जैतम स्वामिना भनमां हुर्स समातो नथी ने श्री जैतम स्वामिए ऐ हाथ लेडीने श्री वीरलुनेश्वरना चरणु कमणने नमरकार कर्यो, अनं भाया रहित ऐवा चतुर्जानी श्री जैतमस्वामि पूर्वनी प्रानि संलारीने ते द्वे वशमां श्राद्धजुने गाम गया ॥ ३ ॥

गौतम गुरु तिहां आविया, वंदाविओ ते विप्र;
 उपदेश अमृत दीधलो, पीधलो तिणे क्षित.
 असमस करतां वंभणे, कमाड वाग्ये थइ वेदन विप्रके. गौ०७०

लावार्थ--हुवे श्री जैतमस्वामि ते गाभमां आव्या ने विप्रे जैतमगुडने वंहना करी, गुडेहे पणु उपदेशदृपी अमृत आप्यु ते विप्रे शिवं पीधुं (=उपदेश सांलण्ये) पणु श्राद्धाषे धर्मभर्त उत्तां खळी वागवार्थी अत्यंत पीडा थर्द आवी ॥ ४ ॥

गौतम गुरुनां वयणलां, नवि धर्यां तिणे कान;
 ते मरी स्त्रीने शीर कृमि श्यो, कामनीने एक तांन;
 उठिया गांयम जाणिओ, तस चरीयोरे पोताने ज्ञानके. गौ०७१

लावार्थ--पुनः अशुलेद्यथी ते विप्रे श्री जैतम गुडनां वयन काने न धर्यां, अने ते विप्र भरणु पाभी

ખીના એક ધ્યાનથી તેના ભરતકમાં કૃભિ (=જૂ) થયો-
ત્યારખાદ શ્રી ગૈતમસ્વામી પણ પોતાના જ્ઞાનથી તેને ભરણ
પામેલો જાણીને ઉઠી ચાલતા થયા ॥ ૫ ॥

ઢાલ ૭ મી. ॥ રાગ રામગિરિ ॥

ચોસઠ મળનાં તે મોતિ ઝગમગેરે, ગાજે ગુહિર ગંભિર સિરેરે;
પુરાં તેત્રીસ સાગર પૂર્વે રે, નાદે લિણા લવસતમિયા સૂર રે;
વારજી વખાળેરે જગ જન મોહિયોરે. ૭૨.

ભાવાર્થ—ચોસઠ મણુનું ૧ મોતી ઉપર ચંદ્રવાના
ભદ્ય લાગમાં જળ હુલે છે, અને ભરતકપર અતિ ગંભીર
અવાજે ગર્જના કરે છે એવા નાદમાં લવ સત્તમીયા (=સ-
વાર્થસિદ્ધ વિમાનના) હેવે। સંપૂર્ણ તર સાગરોપમનું
આચુષ્ય પૂર્ણ કરે છે, શ્રી વીરલગવાન ઉપદેશ આપે છે
કે એવા હેવાદાના સુખમાં આ જગ જન મોહ પામી
રહ્યો છે પણ તે સર્વ અસાર અને અસ્થિર
છે. ॥ ૧ ॥

અમૃતથી અધિકિ મીઠી વાંણિરે, સુણતાં સુખડો જે મનદે સંપજેરે;
તે લહેસ્યે જે પોહોચસ્યે નિર્વાણરે. ૭૩.

ભાવાર્થ—એવી શ્રી વીરલગવાની વાણી અમૃતથી
પણ અધિક મીઠ છે, કે ને સાંભળતાં મનમાં સુખ ઉત્પત્ત
થાય છે. તે વાણીને સાર ને પામશે તેજ મોક્ષ સુખ પણ
પામશે ॥ ૨ ॥

વાંણિ પડછેંદે સુર પડિવોહીયારે, સુણતાં પામે સુખ સંપત્તિની કોડરે.
ક્રિજા અડલ ઉલટથી ઘણારે, આવી બેઠા આગલ બે કરજોડરે.
૭૪.

ભાવાર્થ—શ્રી વીરની વાણીના પ્રતિદ્વનીથી દેવે પણ પ્રતિએધ પામ્યા છે, અને જે વાણી સાંલળતાં કરેટે ગમે સુખ સંપદા પ્રાપ્ત થાય છે, એવી શ્રી વીરની વાણી સાંલળવા (દેવો અને) બીજી જનો પણ અત્યંત ઉમંગથી આવી એ હાથ જેડી એઠા છે ॥ ૩ ॥

સોહમ ઇંદો શાસન મોહીયોરે, પૂછે પરમેસરને તુમ આયરે;
વે ઘડિ વધારો સ્વાતિ થકી પરહુંરે, તો ભસ્મગ્રહ સઘલો દૂરે જાન
યારે વી ૦ ૭૫

ભાવાર્થ:—શ્રી નૈનશાસન ઉપર અત્યંત રાગવાળો
સૌધમ્ ઈન્દ્ર શ્રી વીરલગવાનને પૂછે છે કે હે ત્રણ જગ-
તના નાથ ! આપનું આયુષ્ય માત્ર એ ધડી જેટલું વધારે
તો નિર્વાણ નક્ષત્ર સ્વાતિ ઉપર એકેદો લસ્મગ્રહ સર્વથા
હૂર થઈ જાય ॥ ૪ ॥

શાસન શોભા અધિકિ વાધશ્યેરે. સુખીઆ હોશે મુનિવરના વૃંદરે,
સંવ સયલને સવિ સુખ સંપદારે, હોશે દિનદિનથી પરમાનંદરે.
વી ૦ ૭૬

ભાવાર્થ—અને તે હૂર થવાથી આપના શાસનની
શોભા અધિક વૃદ્ધિ પામશે, સાધુનો સમુદ્ધાય સુખી થશે,
સર્વ સંધને સર્વ પ્રકારની સુખ સંપદા પ્રાપ્ત થશે, અને
દ્વિસે દ્વિસે મહા આનંદની વૃદ્ધિ થશે. ॥ ૫ ॥

ઇંદ્રા ન કદાં રે કહિએ કેહવુંરે, કેણે સાંધ્યું નવિ જાએ આયરે=
ભાવિ પડારથ ભાવે નિપજેરે, જે જિમ સરજ્યો તે તિમ થાયરે.
વી ૦ ૭૭

ભાવાર્થ—હે ઈન્દ્ર એમ કદી પણ કોઈને કહેવાય.

નહિ, કારણુ કે આયુષ્ય કોઈનાથી પણ વધારી શકાય
નહિં, અને ભાવી પહાર્થી પોતાના સ્વસાવ પ્રમાણે થયા
કરે છે, જેણે નેવી રીતે કર્મ બાંધ્યું છે તેને તેવીજ રીતે
ઉદ્ઘયમાં આવે છે માટે આયુષ્ય વધારવાની વાત મિથ્યા
છે ॥ ૬ ॥

સોલ પહોરની દેતા દેશનારે, પરધાનકનામા રૂઅડો અર્જીયણરે;
કહેતાં કાતિવદિ કહું પરગડિરે, વીરજી પોહોતા પંચમી ગતિ રય-
ણરે વી ૦ ૭૮

ભાવાર્થ—હવે શ્રી વીરભગવાન ૧૬ પ્રહુરની દેશના
હેતાં, અને પ્રધાનક નામનું લલું અધ્યયન પ્રરૂપતાં કાર્તિક
વદિ અમાવાસ્યાને દિવસે (=ગુજરાતી આસો વદિ અમા-
વાસ્યાને દિવસે) શ્રી વીરળનેશ્વર એષ એવી પાંચમી મોક્ષ
ગતિને પ્રાપ્ત થયા ॥ ૭ ॥

જ્ઞાન દીવોરે જવ દૂરે થયો રે, તવ કિધિ દેવે દીવાની શ્રેणિરે,
તિમરે ચિહું વરણે દીવા કિથલારે; દિવાલી કહિઓ છે કારણ તેણરે.
વી ૦ ૭૯

ભાવાર્થ—જ્યારે શ્રી વીર ઝૂપી જ્ઞાનનો ભાવ દીવેા
દૂર થયો ત્યારે દેવેએ દીવાચ્ચોન્ના (દ્રવ્ય દીપકની) શ્રેણી
કરી અને તેવી રીતે ચારે વરણુના લોડોએ પણ દીવા
કર્યા તે કારણુથી દીવાચિ દીવાની આલિ એટલે પંક્તિ તે
દીવાચિ કહેવાય છે ॥ ૮ ॥

આસુ પરિપૂરણ નયણ આંખંડલોરે, મૂકી ચંદનની ચેહમાં અંગરે;
રદ્ધો દેવે દહન સંઘલે મિલિજીરે, હા ધિગ ધિગ, સંસાર વિરંગરે;
વી ૦ ૮૦

ભાવાર્થ:—હુએ આંસુ વડે પરિપૂર્ણ એવા નેગવાળો સૈધમેન્દ્ર ચંદ્રનકાણની ચિત્તામાં લગવાનતું શરીર સ્થાપ્તી સર્વ હેવોએ મલી લગવાનને અજી સંસ્કાર કર્યો. હા ધિક્કાર છે ધિક્કાર સંસારના વિરંગને (વિપરિત રંગને) કે આવા ત્રણ જગતના પૂજય પરમાત્માઓની કાયા પણ અસ્થિર હોય છે ! ॥ ૬ ॥

ઢાલ ૮ મી.

રાગ વિરાગ.

વંદેસુ વેં જાઝ વીરો, ઇંમ ગૌતમ ગહગહતા
મારગે આવતાં સાંભળિં, વીર મુગતિ માંહે પોહતારે;
જિનજી તું નિસનેહી મોટો, અવિહં પ્રેમ હતો તુજ ઉપરે,
તે તેં કિધો ખોટોરે જીનજી.

૮૧

ભાવાર્થ:—હુએ હેવશમાં વિપ્રના ગામથી પાછા વળતાં શ્રી જૈતમસ્વામિ હર્ષ પામતા વિચાર કરે છે કે હમણું શિદ્ધ જઈને શ્રી વીરલગવાનને વાંદીશું, પણ માર્ગ-માં આવતાં સાંભળયું કે શ્રી વીર તો મોક્ષમાં પહોંચ્યા એમ સાંલલતાં શ્રી જૈતમસ્વામિ વિલાપ કરવા લાગ્યા કે હે જીનેશ્વર તું ઘણોં નિઃસ્નેહી છે, મારો પ્રેમ તારા ઉપર અતિ ગાઢ હુતો પણ તે પ્રેમ તેં ખોટો કર્યો. ॥ ૧ ॥

હૈ હૈ વીર કર્યો અણઘટતો, મુજ મોકલિઓ ગામેં;
અંતકાલે બેઠાં તુજ પાસે, હું સ્યે નાવત કામરે. જી ૦ ૮૨

ભાવાર્થ:—હે વીર ! મને તમે ગામ મોકલ્યો, તે અહુ અધિત કર્યું, અન્ય સમયમાં હું તારી પાસે એકો છોત તો શું કંઈ કામમાં ન આવત ? ॥ ૨ ॥

ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરિખો મુજ તુંહિ;
વિશવાસી વીરે છેતરીઓ, તે સ્યા અવગુણ મુંહિરે. જી૦ ૮૩

ભાવાર્થ:—હે વીર ! તારે તો મારા સરખા ૧૪૦૦૦ મુનિ છે પણ મારે તો તું એકજ છે, શ્રી વીરે મને વિશ્વાસીને છેતરી ગામ મોકલ્યો તો એવો મારામાં શું અવગુણ હુતો ? ॥ ૩ ॥

કો કેહને છેહડે નવિ વળગે, જો મિલતો હોએ સવલો;
મિલતાસ્યું જેણે ચિત્ત ચોર્યો, તે તિણે કર્યો નિવલોરે. જી૦ ૮૪

ભાવાર્થ:—કોઈ કોઈને ધણો મળતો (સ્નેહ વાળો) હોય તોપણું તે તેને છેડે વળગતો નથી, અને મળતાની સાથે જેણે ચિત્ત ચોર્યું (સ્નેહીથી જેણે આંતરો રાખ્યો) તો તેણે તેને નિખંળ કર્યો જણુવો. ॥ ૪ ॥

નિદુર હેંડા નેહ ન કિજે, નિસનેહી નર નિરખી;
હેંડાં હેજે મિલે જિહાં હરખી, તે પ્રીતલદિ સરીખિરે. જી૦ ૮૫

ભાવાર્થ:—હે હૃદય હુવે તું ધીકું થઈને નિઃસ્નેહી માણુસ જેઈને તું તેની સાથે સ્નેહ ન કર, જ્યા અનેનાં હૃદય હેતથી હર્ષ પામીને મલે તેજ સરખી પ્રીતિ કહેવાય ॥ ૫ ॥
તેં મુજને મનડો નવિ દીધો, મુજ મનડો તેં લીધો;
આપ સવારથ સઘલો કિધો, મુગતિ જઇને સિદ્ધોરે. જી૦ ૮૬

ભાવાર્થ—હે વીર ! તેં તાં મન મને ન આપ્યું
(=તારા મનની વાત મને જણાવી નહિં) પણ માં મન
તેં લીધું (=મારા મનની વાત તેં જાણી લીધી) અને
તેં પોતાનો સર્વ સ્વાર્થ સાધી લીધો કે જેથી મોખમાં
જઈને એડો ॥ ૬ ॥

આજ લગે તુજ મુજસું અંતર, સુપનંતર નવિ હુંતો;
હૈદા હેજે હિયાલિ છંડી, મુજને મુક્યો રોવંતો રે. જી૦ ૮૭

ભાવાર્થ—આજ સુધી તહારે ને ભહારે સ્વર્ણમાં પણ
અન્તર નહોતું, પણ આજે તેં હૃદયના હેતથી હેતાલપણું
છોડો મને તૃદન કરતો મુક્યો ॥ ૭ ॥

કો કેહણું વહુ પ્રેમ મ કરશ્યો પ્રેમ વિટંબણ વિરુદ્ધ;
પ્રેમે પરવત્તા જે દૂર પામે, તે કથા ઘણુ ગિરુદ્ધરે. જી૦ ૮૮

ભાવાર્થ:—અહો જગતમાં કોઈ કોઈની સાથે પ્રેમ ન
કરશો, પ્રેમની વાત બહુ વાંકી-વિપરીત છે, વળી પ્રેમને
પરવશ થયેલાઓ જે હુઃખ પામે છે તેની વાત પણ વણી
મોટી છે ॥ ૮ ॥

નિસનેહી સુખિયા રહે સઘલે, સ સનેહી દુર્ખ દેખે,
તેલ દુગ્ધ પરે પરની પીડા; પામે નેહ વિશેષેરે. જી૦ ૮૯

ભાવાર્થ—ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનનાં
મનુષ્યોઝ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્યો
હુઃખો દેખે છે, વળી સ્નેહના વિશેખપણુથી તેલ અને
દુધની ચેઠ પરથી પીડા પામે છે ॥ ૯ ॥

સમવસરણ કહિઓ હવે હોસે, કહો કુંણ નયણે જોશે;
દ્વા થેનુ પુરી કુંણ દોહસ્યે, વૃષ દધિ કુંણ દિલોસેરે. જી. ૧૦

ભાવાર્થ—અહો હવે સમવસરણુ ક્યારે થશે ! અને
હવે નયનથી અગવાનને ક્યારે જોઈશ ! હ્યા ઝૂપી ગાયને
સંપૂર્ણ કોણુ હોહશે, અને ધર્મ ઝૂપી હહિં કોણુ વલો-
વશે ? ॥ ૧૧ ॥

ઇણ મારગ જે વાલહા જાવે, તે પાછા નવિ આવે;
મુજ હૈડો દુખડે ન સમાએ, તે કહો કુણ સમાવેરે. જી. ૧૧

ભાવાર્થ—વળી જે સ્નેહિઓ એ મારગે જાય છે તેઓ
કેરી પાછા આવતા નથી, માર્દાં મન હુઃખથી સમાતું નથી
તે માર્દાં હુઃખી. મન કોણુ શમાવી શકશે ? ॥ ૧૧ ॥

ઓ દરિસણ વીરા વા'લાને, જે દરિસણના તરસ્યારે;
જો સુહણે કેવારે દેખસું, તો દુખ દુરે કરેશું રે. જી. ૧૨

ભાવાર્થ—હે વીર ! જે આપના દર્શનના તરસ્યા
છે એવા આપના સ્નેહિને એકવાર દર્શન આપે!, જે કોઈ
વખત સ્વર્ણને પણ આપનાં સાક્ષાત્ દર્શન થશે તો પણ હું
માર્દાં હુઃખ ફૂર કરીશ ॥ ૧૨ ॥

પુણ્ય કથા હવે કુણ કેલવશે, કુણ વાલહા મેલવશે;
મુજ મનડો હવે કુણ ખેલવશે, કુમતિ જિમતિમ લવસેરે. જો. ૧૩

ભાવાર્થ—હવે ધર્મ કથા કોણુ કેળવશે ! મારા
સ્નેહિ વીરને કોણુ મેળવશે ! હવે માર્દાં મન કોણુ રંજન
કરશે ! અને હવે કુમતિઓ ઝાવે તેમ ઘોલશે ॥ ૧૩ ॥

कुण्ठ पूछ्यानो उचर देशे, कुंण संदेह भांजशे; .

संघ कमळ वन किम विकससे, हुं छद्मस्था वेसेरे. जी० १४

भावार्थ—हुवे पूछ्यानो उत्तर कैल्यु आपशे । मनने।
संहेह कैल्यु भागशे ! संधृपी कमण्ठुं वन केवी रीते
प्रकृति थशे! हे प्रभु ! हुं तो हज छधस्थना वेषभां
क्षुं ॥ १४ ॥

हुं परापुरवसुं अजाण, में जिन वात न जाणि;

मोह करे सवि जग अनाणी, एहवी जीनजीनी वाणीरे. जी. १५

भावार्थ—माटे पूर्वोपर वातो हुं शुं जाणुं ? हे
जुनेश्वर मे आपना मननी वात न जाणी, अने भेष
सर्वं जगतने असाणी अनावे छे, हे जुनेश्वर ! आपनी
अवीज वाणी छे ॥ १५ ॥

एहवे जिन वयणे मन वाप्यो, मोह सबल बल काप्यो;

इंण भावे केवल सुख आप्यो, इंद्रे जिनपद थाप्योरे. जी० १६

भावार्थः—अटलाभां श्री जुनेश्वरनी वाणीभां मन
काण्युं, रागने असार जाइयो ने भावना अणभां वधतां
भेषना अणवान सैन्यने हठावी अज चढते भावे श्री जै-
तम रवाभीअे केवणज्ञान इपी सुख प्राप्त कर्युं, अने छन्दे
पल्यु श्री जैतम स्वाभीने श्री वीरनेपदे स्थाप्यां ॥ १६ ॥

इंद्रे जुहारया भट्टारक जुहार भट्टारक तेणे;

पर्वं पन्होतुं जगमां वाप्युं, ते किजे सवि केणेरे. जी० १७

भावार्थः—श्री जैतमस्वाभि भट्टारकने छन्दे जुहा-

થો તેથી જુહાર લડ્યારક એવું પનોતું પર્વ જગતમાં હૈણાયું
તે સર્વ કોઈ કરે છે ॥ ૧૭ ॥
રાજા નંદિવર્દ્ધન નુતરીઓ, ભાઇ બહિનર બીજે;
તે ભાવડ બીજ હૂઈ જગ સઘલે, બેહેન બહૂપરે કિજેરે. જિ૦ ૯૮

ભાવાર્થ:—ખીજને દિવસે નંદિવર્દ્ધનને શોક ટાળવા
માટે નંદિવર્દ્ધનની બહેને નંદિવર્દ્ધન લાઇને જમવા નેતા-
થો તેથી સર્વ જગતમાં ભાવડ ખીજ (-લાઇખીજ) ના-
મનું પર્વ પ્રવત્યું, તે પર્વ સધળી બહેનો ધણે પ્રકારે
કરે છે ॥ ૧૮ ॥

દાલ ૮ મી.

વિવાહલાની.

પહિરીએ નવરંગ ફાલડીએ, માંડિ મૃગમદ કેસર ભાલડીએ,
જીવ જીવકે શ્રવણે જ્ઞાલડીએ, કરિ કંઠે મુગતાફલ માલડીએ. જિ૧૯

ભાવાર્થ:—લલાટમાં કસ્તુરી ને કેશરનું મંઠન કરી
નવરંગ ચીર ઘેરીયે, જળહળતાં કુંડળ કાને ઘેરીયે, ને
ગળામાં મેતીની ભાળા ઘેરીયે ॥ ૧ ॥

ઘર ઘર મંગલ માલડીએ, જપે ગોયમ ગુણ જપમાલડીએ;
પહોતલો પરવ દીવાલડીએ, રમે રસ ભર રામત વાલડીએ. ૧૦૦

ભાવાર્થ:—એ પ્રમાણે ધેરેધેર મંગળમાળા પૂર્વક
જપમાળાવડે (=નવકારાવલિવડે) શ્રી ગૌતમ સ્વામીના
ગુણુ જીપીયે, કારણુ કે દિવાળી પર્વ આવી પહેલ્યું છે,
તે અવસરે ભાળકો પણ હર્ષ ભર્યાં થઈ રમતો રમે ॥૨૮॥

ज्ञोक संताप सवि कापीओए, इंद्रे गोयम वीरपदे यापीओए;
नारी कहे सांभल कंतडाए, जपो गोयम नाम एकंतडाए. १०१

लावार्थः——श्री गैतम स्वाभिने तेवण ज्ञान थवा थी श्री वीर
संभांधि शेषक संताप सबे दूर कर्यो, अने सौधमेन्द्रे श्री
गैतमप्रभुने श्री वीरने पहे स्थाप्या, स्वी प्रेताना पतिने
कुछे छे ते हे स्वाभि ! अवा श्री गैतमस्वाभिनुं नामज
अङ्कान्ते जपो ॥ ३ ॥

ल्यो लख लाभ लखेशरीए, ल्यो मंगल कोडी कोडेशरीए;
जाप जपो थइ सुतपेसरीए, जीम पामीए कङ्डि परमेसरीए. १०२

लावार्थ——श्री गैतम स्वाभिनुं नाम जपवाथी ल-
अपतिओ लाखोना लाख मेणवे, कोठपतिओ उरेहो भंग-
गिक प्राप्त करे, भाटे अत्यंत तपेश्वरी थई (=तप करवा
पूर्वक) श्री गैतम स्वाभिनो जाप जपो के जेथी परमे-
श्वरनी कङ्डि पामीओ (=परमात्म पद मेणवीये) ॥ ४ ॥

लहिएं दिवालडी दाढ़लो ए, एतो पुण्यनो ट्वको टालु
ओए; सुकृत सिगि हृढ करो पालडीए, जिम घर होय नित्य
दिवालडीए. १०३

लावार्थ——हिवाळीनो हिवस आवे ते तो पनेतुं मु-
न्यनुं ट्यकुं (=टाणु-अवसर) छे, ते हिवसे मुन्य इपी
लक्ष्मीनी पाण इरे करे के जेथी प्रेताने बेर नित्य द्वी-
वाति वर्ते ॥ ५ ॥

ઢાલ ૧૦ મી.

હવે મુનિ સુવ્રત સીસોરે, જેહની સબળ જગીસો;

તે ગુરુ ગજપુરે આવ્યારે, વાદી સવિ હાર મનાવ્યા. ૬

ભાવાર્થ—હવે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય કે જેનું મહાત્મય જગતમાં સખળ છે, તે મુનિરાજ ગજપુર નગરમાં પદ્ધાર્યા, ને સર્વ વાદીઓને હાર મનાવી ॥ ૧ ॥ પાવસ ચડમાસું રહિયારે, ભવિયણ હિડે ગહગહીઆરે; નમુંચિ ચક્રવર્તી પદ્ધરે, જસુ હિયડે નવિ છદ્ર. ૨

ભાવાર્થ:—તે નગરમાં મુની વર્ષાચીમાસુ રહ્યા અને તેથી ભવ્ય જનોનાં હૃદ્ય હુર્ખ વાળાં થયાં, તે અવસરે તે નગરમાં પદ્ધ નામે ચક્રવર્તી છે, ને તેનો નમુચિ નામે પ્રધાન છે, તેમાં ચક્રવર્તી સરળ હૃદ્યનો છે ॥ ૨ ॥

નમુંચિ તસ નામે પ્રધાનરે, રાજા દિયે બહુ માન;

તિગે તિહાં રિદ્વાવી રાયરે, માગિ મોટો પસાય. ૩

લિધો ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ;

એવે મુનિસું વિરોધ્યારે, તે કિણે નવિ પ્રતિબોધ્યો. ૪

ભાવાર્થ—તે રાજ પોતાના નમુચી પ્રધાનને બહુ માન સત્કાર કરે છે, તે પ્રધાને પણ રાજનું ચિત્ત રંજન કરી એક મોટું પણ (=વચન) માણ્યું, તે વચનથાંધથી રાજ પાસે તે દ્વિવસથી માંડીને ઉ દ્વિવસ સુધીનું રાજન્ય લીધું, અને પ્રથમ તે મુનિવર સાથે એ પ્રધાને જે ધણો વિરોધ કર્યો છે તે હજ સુધી કોઈનાથી પ્રતિષોધ પામી

પોતાનો વિરોધ ટાજ્યો નહેતો ॥ ૩ ॥ ૪ ॥
 તે મુનિ સું કહે બંડોરે, મુજ ધરતિ સવિ છંડો;
 વિનવિઓ મુનિ મોટોરે, નવિ માને કર્મિ ખોટો. ૫

ભાવાર્થ—હુવે તે વિરોધ સંલાદીને તે મુનિની સાથે
 તેણે ક્ષેત્ર માંઢ્યો અને પોતે સાત હિવસનો રાજ હોવા-
 થી મુનિને આજા કરી કે મારા તાણાની સર્વ પૃથ્વી છો-
 ટીને તમો સર્વ મુનિયો મારા રાજ્યથી બહાર નિકળો,
 એ વખતે આચાર્યો એને ધણ્યો વિનોદ્યો (=સમજોદ્યો)
 પણ તે કુરુક્ષેત્રે કંઈ પણ માન્યું નહિ. ॥ ૫ ॥

સાઠસથાં વર્ષ તપ તપિઓરે, જે જિન કિરીયાનો ખરીઓ;
 નામે વિષ્ણુ કુમારે, સયન લવધિનો ખંડાર. ૬

ભાવાર્થ—આચાર્યો વિચાર કર્યો કે આ રીતે સમ-
 જાયાથી આ પ્રધાન સમજતો નથી માટે જેણે ૬૦૦૦
 વર્ષ તપ કર્યો છે, અને જૈનક્રિયાનો ખપી (=રૂચિવાળો),
 અને અનેક લખિનો લંડાર છે તેને મેરુ પર્વતપરથી
 અહિં એલાવીએ એમ વિચારી આચાર્યો પોતાના શિષ્ય
 મેાકલી વિષ્ણુકુમાર મુનિને એલાંદ્યો ॥ ૬ ॥

ઉઠ ક્રમ ભૂમિ લેવારે, જોવા ભાઇની સેવા;
 રૂં ત્રિપદિ ભૂમિ દાનરે, ભલે ભલે આવ્યા ભગવાન. ૭

ભાવાર્થ—હુવે વિષ્ણુ કુમાર મુનિએ આવી મુનિને:
 ઉપદ્રવ સાંસળી રાજ સલામાં જઈ નમુચિની લક્ષ્ણ જણ્યવા
 માટે, અને મૂર્ખિનો ઉપદ્રવ ટાળવા માટે તાં પગલાં લૂભિ
 માણી, ત્યારે નમુચિએ કણું કે ભલે આપ ભગવાન પધાર્યા

છે તો ભાત્ર ઉ પગલાં જેટલી લૂભિ આપું છું તેટલામાં
સર્વ મુનિઓએ રહેલું. ॥ ૭ ॥

ઇઝે વયણે ઘડહડીઓરે, તે મુનિ બહુ કોપે ચદિઓ;
કિધો અદ્ભૂત રૂપરે, જોયણ લાખ સરૂપ. ૮

ભાવાર્થ—ઈત્યાદિ અનેક વક્ત વચ્ચેનોથી વિષ્ણુકુમાર
મુનિ ધડ ધડયા અને અત્યંત કુદૈ ભરાયા, પોતાનું લાખ
ચેાજન ઉંચું અદ્ભૂત ઇપ વિકુઠું. ॥ ૮ ॥

પ્રથમ ચરણ પૂર્વે દીધોરે, બિજો પશ્ચિમે કિધો;
ત્રિજો તસ પુંઠે થાપ્યોરે, નમુંચિ પાતાલે ચાંપ્યો. ૯

ભાવાર્થ—ત્યાં પ્રથમ પગલું પૂર્વ દિશામાં (જંબુ-
કીપના પૂર્વ કિનારે) અને બીજું પગલું પશ્ચિમ દિશામાં
મેદ્યાં, અને તૃદ્યું તે બોલ હવે ત્રીજું પગલું જમીન કર્દ
આપે છે ? કંઈ પણ જવાખ નહિં આપવાથી ત્રીજું
પગલું તે પાપી નમુચીની પીઠ ઉપર ધરી નમુચિને પાતા-
ળમાં ચાંપ્યો. ॥ ૯ ॥

થરહરીઓ ત્રિમૂવન્નરે, ખલમલિઓ સવિ જન;
સલસલિઓ સુર દિનરે, પડયો નવિ સાંભલિએ કન્ન. ૧૦

ભાવાર્થ—આ મહા ઉત્પાત થવાથી ત્રણે કુવન
કંપાયમાન થયાં, સર્વ લોક ખળસણી ઉઠ્યો, દેવલોક પણ
સળસણી ઉઠ્યો, અને કાને પડ્યું પણ સંલળાય નહિં
એવો શોર ભચી રહ્યો. ॥ ૧૦ ॥

એ ઉત્પાત અત્યંતરે, દૂરિ કરો ભગવંત;
હૈ હૈ સયું હવે થાશે રે, બોલે બહુ એક સાસે. ૧૧

ભાવાર્થ—આ ધ્યેં માટે ઉત્પાત થયો તે હે ભગવનું
દૂર કરો, અરે અરે હવે શું થશે ! એમ બહુ લોક એકી-
શ્વાસે વ્યાખ્યા લાગ્યે. ॥ ૧૧ ॥

કરણ કિન્નર દેવા રે, કડુઆ કોધ સમેવા;
મધુર મધુર ગાએ ગિતરે, બે કર જોડિ વિનીત. ૧૨

ભાવાર્થ—સૌધર્મેન્દ્રે આ ઉત્પાત શાન્ત કરવા માટે
હેવ દેવીઓને મોકલ્યા તે કિન્નર દેવોએ શ્રીવિષ્ણુ કુમારને
કડવો કોધ શભાવવા માટે તેમના કાનમાં મીઠાં મીઠાં ગીત
ગાવા પૂર્વક એ હાથ નેકીને વિનંતિ કરવા લાગ્યા. ॥૧૨॥
વિનય થકી વેગે વળિઓરે, એ જિન શાસન વળિઓ;
દાનવ દેવે ખ્રમાવ્યો રે, નર નારીએ વધાવ્યો. ૧૩

ભાવાર્થ—એ પ્રમાણે દેવોના અત્યંત વિનયથી મુનિનો
કોધ શિદ્ધ શમી ગયો એ જુનશાસનમાં વિનય મહા
ખળવાન છે, કોધ શમેલા વિષ્ણુ કુમાર મુનિને હેવ દાન-
વેએ ખમાંવ્યા અંને ખી પુર્ખોએ વધાવી લીધા. ॥ ૧૩ ॥
ગાવલડી મેસ ભડકી રે, જે દેખી દુરે તઢકી રે;
તે જતને ગ્રહિ છે રે, આરતિ ઉતારી મેરઝે રે. ૧૪

ભાવાર્થ—ગાયો અને લોંસો વગેરે લડકીને ને
મુનિનું રૂપ હેખી હોર તોડાવી દૂર નાસી ગઈ હતી તે પણ
જતના પૂર્વક પાછી ઠેકાણે આણી, અને લોકોએ મેરદ્ધ-
યાથી ઉપદ્રવ શમ્યાની આરતિ ઉતારી. ॥ ૧૪ ॥
નજીલે અવતારે આવ્યા રે, જીવિત ફલ લહિ ફાવ્યા;
શેવ સુંહાલિ કંસાર રે, ફલ લ્યું નવે અવતાર રે. ૧૫

લાવાર્થ—નવો અવતાર પામ્યા અને જીવતરનું ક્રીણ
પામીને ક્રાબ્યા છીએ એમ વિચારી લોકોએ હુંથી જોવો
સુંહાળી અને કંસાર વિગેરે મંગલિક જમણો કર્યો અને
નવો અવતાર પામ્યાનું ક્રીણ લીધું. ॥ ૧૫ ॥

છગણ તણો ઘરબાર રે, નમુંચિ લખ્યું ઘર નારે;
તે જીમ જીમ ખેરુ થાય રે, તિમ તિમ દૂખ દૂરે જાય રે. ૧૬

લાવાર્થ—હુવે ધરેધર ધરને ભારણે સ્લીએએ
છાણુનો નમુચિ અનાંદ્યો તે છાણુનો નમુચી જેમ જેમ
ક્ષય પામતો જય તેમ તેમ દુઃખ પણ ક્ષય પામતું જય
એમ માનવા લાગ્યા. ॥ ૧૬ ॥

મંદિર મંડાણ માંડયા રે, દાલિદ્ર દુખ દુરે છાંડયા;
કાતિ શુદ્ધિ પડવે પરવેરે, ઇંમ એ આદરીઓ સર્વે. ૧૭

લાવાર્થ—ઉત્પાત શમ્યાના હુંથી લોકોએ પેતાનાં
ધરે શાણુગારવા માંડયાં, અને દારિદ્ર દુખ વિગેરે સહુ ફર
થયું એમ માનવા લાગ્યા, એ પ્રમાણે આ પવં કાર્તિક
સુદિ પડવાને દિવસે સર્વ લોકોએ આદ્યું ॥ ૧૭ ॥

પુણે નરભવ પાંમિ રે, ધર્મ પુન્ય કરો નરધાંમી;
પુન્યે કુદ્ધિ રસાલિ રે, નિત નિત પુન્યે દિવાલી. ૧૮

લાવાર્થ—ધણા પુણ્યથી આ મનુષ્યનો લવ પામી
હે મનુષ્યો સર્વ સુખનું સ્થાન એવું ધર્મ પુન્ય કરો,
પુન્યથી રસાલ ઝૂદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પુન્યથી જ ઘેર
નિત્ય નિત્ય દિવાળી વતો છે ॥ ૧૮ ॥

કળાશ.

जिन तुं निरंजण सजल रंजण, दुख भंजण देवता;
 यो सुख सांमि मुगति गांमि, वीर तुङ्ग पाये सेवता.
 तप गच्छ गयण दिणंद दह दिसे, दीपतो जग जांणिएं;
 श्री हीरविजय सुंरिद सहगुरु, तास पाट वखाणीये. ૧૯

ભાવાર્થ—હે જીનેશ્વર ! તું નિરંજન (કર્મદ્વારાનથી રહિત,) તેજવંત, ત્રણ ભુવનના ચિત્તને રંજન કરનાર, અને સર્વનું દુઃખ ભાગનાર દેવ છે, માટે મોક્ષ ગતિમાં ગયેતા હે વીર જીનેશ્વર ! અમને સુખ આપો, અમો આપના ચરણું કમળની સેવા કરીએ છીએ, તપગચ્છ દુઃખી આકાશમાં સૂર્ય સમાન દર્શાવી દીપતો અને જગતમાં પ્રખ્યાત એવા શ્રી હીર વિજયમૂર્તિ સહગુરુ તેમની અશંશા કરવા યોગ્ય પાટે (આ સ્તવનના રચનાર કૈણું છે તે કહેવાય છે.) ॥ ૧ ॥

શ્રીવિજયસેન સુરીસ સહ ગુરુ, વિજયદેવ સૂરિસરુ;
 જે જપે અહનિશ નામ જેહનો, વર્દ્ધમાન જિણેશ્વરુ.
 નિર્વાણ તવન મહિમા ભવન, વીર જિનનો જે ભણે;
 તે લહે લિલાલબિંધ લચ્છો, શ્રી ગુણ હર્ષ વધાપણે. ૨૦

ભાવાર્થ—શ્રી વિજયસેન સૂર્ય સહગુરુ થયા, તેમની પાટે શ્રી વિજય દેવ સૂર્ય થયા કે જેણો રાત્રિ દિવસ શ્રી વર્દ્ધમાન જીનેશ્વરનું નામ જપે છે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરના મહિમાના મંદિર દુઃખ આ નિર્વાણ સ્તવન

ને કોઈ લણે ગણે તે લીલા પૂર્વક લખિથયો અને લક્ષ્મી પામે એમ શ્રીગુણુહુણ્ણ નિર્વાણ ભણિમાને વધાવે છે.
 વીર હમણે આવે છે મારે મંદિરીએ, મંદિરીએ વીર મંદિરીએ, વી૦
 પાયે પડીને મેતો ગોદ બિછાઉ, નિત નિત વીનતઢી કરીએ. વી૦૧
 સજન કુદુંબ પુત્રાદીકને, હરખે ઇણ પેરે ઉચ્ચરિએ. વી૦૨
 જવ પ્રભુ આંગળે વીર પધારે, તવવચ્છ સનમુખ ડગ ભરીએ. વી૦૩
 સયણા સુણોને ભવિયણ, પડિલાભિ જે તો ભવસાયર તરીએ. વી૦૪
 અપ્રતિબંધ પણે મહાવીરજી, ઘર ઘર ભીક્ષાને ફરીએ. વી૦૫
 અભિનવ શેઠ તણે ઘેર પારણું, કિધું ફરતાં ગોચરીએ વી૦૬
 ઇમ ભાવના કરતાં શ્રવણે સુણી, દેવ દંદુભીરે ચિત્ત ભરીએ. વી૦૭
 બારમા કલ્પે જિરણ આયુવાંધ્યં, વીરજિનને ઉત્તમચિત્તધરીએ. વી૦૮
 તસપદ પદ્મની સેવા કરતાં, સેજે શિવ સુંદરી વરીએરે. વી૦૯

લાખાર્થ—જીરણું શેઠની લાવનાનું આ સ્તવન છે—

શ્રી વીર લગ્વાન હુમણુંજ મારે માન્દરે પધારશે, તે વ-
 ખતે હું પગે પડીને ઓળા પાથરીશ, ને નિત્ય નિત્ય વિ-
 નંતિ કરીશ ॥ ૧ ॥ પુનઃ મારા સ્વજન કુદુંખ અને પુ-
 ત્રાદિ પરિવારને હર્ષ પૂર્વક એ પ્રમાણે કહીશ કે ॥ ૨ ॥
 જ્યારે વીર પ્રભુ આપણે આંગળે પધારે ત્યારે હે પુત્રો
 તમો કેટલાંક ઠગલાં સુધી રહ્યામા જને, ॥ ૩ ॥ વળી હે
 લભ્ય સ્વજનો તમે સાંલળો કે એ શ્રી વીર પ્રભુને પ્રતિ
 લાલ ફૂછે (=૦હોરાવીયે) તો આપણે આ લવ સમુદ્રનો
 પાર પામીયે ॥ ૪ ॥ શ્રી વીર લગ્વાન તો અપ્રતિબંધ
 પણે (=કોઈના ઉપર રાગ રાખ્યા વિના) ઘેરેઘેર લિક્ષા

ઝરે છે ॥ ૫ ॥ પણ શ્રી વીર સ્વામિએ ગોચરીએ ઝરતાં
 અલિનવ શેડને ઘેર પારણું કર્યું, ॥ ૬ ॥ એ પ્રમાણે જ-
 રણ શેડ ભાવના ભાવતાં ભાવતાં ચિત્તના ઉદ્ધાસ પૂર્વક
 દેવ દંડલિ વાગતી કાને સાંખળી, ॥ ૭ ॥ ને તેજ વખતે
 જરણ શેડે ૧૨ મા કલ્પનું આચુષ્ય ધાંદ્યું. હવે કાવ્ય
 કર્તાં કહે છે કે ઉત્તમ એવા વીર જુનેશ્વરને ચિત્તમાં સમ-
 રણ કરીયે (ધીજે અર્થ—ચારિત્રમાં પરાક્રમી એવા શ્રી જ-
 નવિજ્યજી અને તેમના શિષ્ય શ્રી ઉત્તમ વિજ્યજીને
 ચિત્તમાં સમરણ કરીયે.) ॥ ૮ ॥ તેમના ચરણ ઝૂપી પદ્મ-
 ની=કમળની સેવા કરતાં (ધીજે અર્થ—તેમની એટલે શ્રી
 ઉત્તમ વિજ્યજીની પાટે થયેલા શ્રી પદ્મવિજ્યજી કહે છે
 કે તેમના ચરણ કમળની સેવા કરતાં લોલા માત્રમાં મુહિત
 ઝૂપી ખીને વરીયે (=મોક્ષમાં જઈએ.) ॥ ૯ ॥



વीશ સ્થાનક તપમાં ખમાસમણુ દેતાં બોલવાના

કુહા.

જે જે પદ્ધનાં જેટલાં ખમાસમણુ દેવાનાં હોય ત્યારે તે
પદ્ધનો હુહો દરેક વખત ઓલીને ખમાસમણુ દેવાં.

૧ પહેલું પરમ પંચપરમેષ્ઠીમાં, પરમેશ્વર લગવાન;
અરિહંતપદ. ચ્યાર નિષ્ઠે ધ્યાઈએ, નમોનમો જિનભાણુ. ૧

૨ જું ગુણુ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉનશે;
સિદ્ધપદ. અધ્યક્રમ મળક્ષય કરી, લયે સિદ્ધ નમોન તાસ.૨

૩ જું. લાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃદ્ધિ;
પ્રવચનપદ. ત્રિભુવન જીવને સુખકરી, જ્યજ્ય પ્રવચન દૃષ્ટિ.૩

૪ થું. છત્રીશ છત્રોશી ગુણો, યુગ પ્રધાન મુણીદિ;
આચાર્યપદ જિનમત પરમત જાણુતા, નમોનમો તે સૂરીદિ.૪

૫ મું. તજ્જ પરપરિણુતી રમણુતા, લહે નિજભાવ સ્વરૂપ;
થિવિરપદ. સ્થિર કરતા ભનિ લોકને, જ્યજ્ય થિવિર અનૂપ.૫

૬ હું. ઓધ સૂક્ષ્મ વિષુ જીવને, નહોય તત્ત્વ પ્રતીત;
ઉપાધ્યાયપદ. લાણે લાણુવે સૂત્રને, જ્યજ્ય પાઠક ગીત. ૬

૭ મું. સ્યાદવાદ ગુણુ પરિણુભ્યો, રમતા સમતા જંગ;
સાધુ પદ. સાધે શુદ્ધાનંદતા, નમોન સાધુ શુભ રંગ. ૭

૮ મું. અધ્યાતમ જાને કરી, વિઘ્ને ભવ ભ્રમ લીતિ;
જાન પદ. સત્ય ધર્મ તે જાન છે, નમોનમો જાનની રીતિ.૮

૯ મું. લોકલોકના ભાવ જે, કેવલિ ભાવિત જેહ;

દર્શન પદ. સત્ય કરા અવધારતો, નમોન નમોન દર્શન તેહ.૯

૧૦ મું. શૈચ મૂળથી મહા ગુણી, સર્વ ધર્મનો સાર;

વિનય પદ. ગુણુ અનંતનો કંદાએ, નમોન વિનય આચાર. ૧૦

- ૧૧ મું. રત્ન ત્રયો વિષુ સાધના, નિષ્ઠળ કહી સહીવ; ચારિત્રપદ. લાવરયણું નિધાન છે, જ્યન્ય સંજમ અવ. ૧૧
- ૧૨ મું. જિનપ્રતિમા જિનમંહિરાં, કંચનનાં કરે જે જેહ;
- અદ્ભુતય્યોપદ. અદ્ભુતતથી બહુ દ્રળ લહે, નમોનમો શીયલ સુદેહ. ૧૨
- ૧૩ મું. આત્મ બોધ વિષુ જે કિયા, તે તો બાળક ચાલ; કિયા પદ. તત્ત્વા રથથી ધારીયે, નમો કિયા સુવિશાલ. ૧૩
- ૧૪ મું. કર્મ ખપાવે ચીકણું, ભાવ મંગલ તપ જાણ; તપ પદ. પદ્ધ્યાસ લખિધ ઉપજે, જ્ય જ્ય તપ ગુણુ ઘાણ. ૧૪
- ૧૫ મું. છદુ છદુ તપ કરે પારણું, ચડ નાણુ ગુણુ ધામ; ગોયમ પદ. એ સમ શુલ પાત્ર ડો નહિ, નમો નમો ગોયમસ્વામ. ૧૫
- ૧૬ મું. દોષ અદારે ક્ષય ગયા, ઉપન્યા ગુણુ જસ અંગ; જિન પદ. વેયાવચ્ય કરીયે મુદા, નમો નમો જિન પદ સંગ. ૧૬
- ૧૭ મું. શુદ્ધાતમ ગુણું રમે, તલુ ઈંદ્રિય આશંશા; સંયમ પદ. થિર સમાધિ સંતોષમાં, જ્ય જ્ય સંજમ વંશ. ૧૭
- ૧૮ મું. જ્ઞાનવૃક્ષ સેવો લવિક, ચરિત્ર સમક્રિત મૂળ; અભિનવ જ્ઞાન અજર અમર પદ દ્રળ લહે, જિન વર પદવી કુલ. ૧૮
- ૧૯ મું. વકંતા શ્રોતા ચોગથો, શ્રુત અનુભવ રસ પીન; શ્રુત પદ. ધ્યાતા ધ્યેયની એકતા, જ્ય જ્ય શ્રુત સુખલીન. ૧૯
- ૨૦ મું. તીર્થ ચાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; તીર્થ પદ. પૂરમાનંદ વિલાસતાં, જ્ય જ્ય તીર્થ જહાજ. ૨૦

શ્રી વીશ સ્થાનક તપ-વિધિ.

| ક્રમાંશ | વીશ-પદનામાં નામો. | નવ કાર વાલી | કાઉસ ગગના દોગર્સસ | ખમાસ મણુ | પ્રેદ- ક્ષિણું | | |
|---------|----------------------|-------------------|-------------------------|-------------|-------------------|-----------------------|-----------|
| | | | | | | તપમાં | દરેક પદના |
| ૧ | નમો અરિહંતાણું | ૨૦ | ૨૪ | ૨૪ | ૨૪ | આ તપમાં | દરેક પદના |
| ૨ | સિંહાણું | ૨૦ | ૧૫ | ૧૫ | ૧૫ | વીશ વીશ ઉપવાસ કરી | |
| ૩ | પવયણુરસ | ૨૦ | ૪૫ | ૪૫ | ૪૫ | આપવા જોઈએ, | એમ |
| ૪ | આયરિયાણું | ૨૦ | ૩૬ | ૩૬ | ૩૬ | અદેક પદની અ- | |
| ૫ | થેરાણું | ૨૦ | ૧૦ | ૧૦ | ૧૦ | કેક ઓલી વીશ પદ | |
| ૬ | ઉવજાયાણું | ૨૦ | ૨૫ | ૨૫ | ૨૫ | વીશ ઓલી પૂર્ણ | |
| ૭ | લોઅેસાવ | ૨૦ | ૨૭ | ૨૭ | ૨૭ | થાય તે અદેક ઓલી છ | |
| | સાહુણું | | | | | મહિનામાં છેવટ પુરી ક- | |
| ૮ | નાણુરસ | ૨૦ | ૫ | ૫ | ૫ | રવી જોઈએ એટલે દરશ | |
| ૯ | દંસણુરસ | ૨૦ | ૬૭ | ૬૭ | ૬૭ | વર્ષે વીશ ઓલી પૂર્ણ | |
| ૧૦ | વિણુધરસ | ૨૦ | ૧૦ | ૧૦ | ૧૦ | થાય. | |
| ૧૧ | ચરિતરસ | ૨૦ | ૭૦ | ૭૦ | ૭૦ | વીશ વીશ ઉપવાસ | |
| ૧૨ | ભવયધારિણું | ૨૦ | ૮ | ૮ | ૮ | સુધી એક એક પદનું | |
| ૧૩ | કિરિયાણું | ૨૦ | ૨૫ | ૨૫ | ૨૫ | આરાધન કરવું એટલે | |
| ૧૪ | તવરસ | ૨૦ | ૧૨ | ૧૨ | ૧૨ | અદેક પદનું વીશ વાર | |
| ૧૫ | ગોયમસસ | ૨૦ | ૨૮ | ૨૮ | ૨૮ | ગણુણું કાઉસસગ ખમા- | |
| ૧૬ | જિણુણું | ૨૦ | ૨૦ | ૨૦ | ૨૦ | સણું આદિ કરવાં. | |
| ૧૭ | સંયમધારિણું | ૨૦ | ૧૭ | ૧૭ | ૨૭ | | |
| ૧૮ | અલિનવ | ૨૦ | ૫૧ | ૫૧ | ૫૧ | | |
| | નાણુરસ | | | | | | |
| ૧૯ | સુયરસ | ૨૦ | ૧૨ | ૧૨ | ૧૨ | | |
| ૨૦ | તિત્થરસ | ૨૦ | ૫ | ૫ | ૫ | | |

નવ પદ આરાધનમાં દરેક પદે બોલવાના દુહા.

- ૧ દુઃ અરિહંત પદ ધ્યાતો થકો, દંવહ શુણુ પજાયરે,
અરિહંતપદ. લેહ છેદ કરી આતમા, જ દ્વિ મળે સવિ આઈરે;
વીર જિનેશ્વર ઉપદિશે, સાંસળો ચિત્ત લાઈરે,
આતમ ધ્યાને આતમા, ઋદ્ધ મળે સવિ આઈરે.વી.૧
- ૨ જું. દૃપાતીત સ્વભાવ જે, કેવળ હંસણુ નાણુિરે;
સિદ્ધપદ. તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધગુણુ ખાણુિરે.વી.૦૨
- ૩ જું. ધ્યાતા આચારજ લલા, મહામંત્ર શુલ ધ્યાનીરે;
આચાર્ય પદ.પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણોરે.વી.૦૩
- ૪ થું. તપ સજનાએ રત સદા, દ્વાર્ધય અંગનો ધ્યાતારે;
ઉપાધ્યાયપદ. ઉપાધ્યાય તે આતમા,જગ બંધવજગ ભૂતારે.વી.૦૪
- ૫ મું. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરએ નવિ સોચેરે;
સાધુ પદ. સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લેચેરે.વી.૦૫
- ૬ હું. શમ સંવેગાદિક ગુણું, ક્ષય ઉપશમે જે આવેરે;
દર્શિન પદ. દર્શિન તેહિજ આતમા, શું હોય નામ ધરાવેરે.વી.૦૬
- ૭ મું. જ્ઞાનાવરણું જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે;
જ્ઞાન પદ. તો હુએ એહિજ આતમા, જ્ઞાન અણોધતાભયરે.વી.૦૭
- ૮ મું. જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતોરે;
ચારિત્ર પદ. લેશ્યા શુદ્ધ અલંકયો, મોહવને નવિ ભરતોરે.વી.૦૮
- ૯ મું. ધરણા રોધે સંવરો, પરિષુત્તિ સમતા ચોગેરે;
તપ પદ. તપ તે એહિજ આતમા,વતો નિજ ગુણુ કોગેરે.વી.૦૯

શ્રી સિદ્ધચક (નવપદ) ઓળી વિધિ.

| ક્રમ | પદનામનામો. | બાળ | | નાના | | સંસ્કાર | | હૃત્ય | | ગુરુ | | લોજન કર્તા |
|------|-----------------------|-----|------|---------|-------|---------|------|-------|------|------|------|---------------|
| | | બાળ | નાના | સંસ્કાર | હૃત્ય | ગુરુ | ગુરુ | હૃત્ય | ગુરુ | ગુરુ | ગુરુ | |
| ૧ | ઓઁ હૌઁ નમો અરિહંતાણું | ૨૦ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ચોખા, પ્રમુખ |
| ૨ | ,, નમો સિદ્ધાણું | ૨૦ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ધર્તિ, પ્રમુખ |
| ૩ | ,, આયરિયાણું | ૨૦ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ૩૬ | ચણૂલ, પ્રમુખ |
| ૪ | ,, ઉવજાયાણું. | ૨૦ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | ૨૫ | મગ, પ્રમુખ |
| ૫ | ,, દોષે સવસાહુણું | ૨૦ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | ૨૭ | અડદ, પ્રમુખ |
| ૬ | ,, દંસણુસ્સ | ૨૦ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ૬૭ | ચોખા, પ્રમુખ |
| ૭ | ,, નાણુસ્સ | ૨૦ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ૫૧ | ,, |
| ૮ | ,, ચરિતસ્સ | ૨૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ૭૦ | ,, |
| ૯ | ,, તવસ્સ | ૨૦ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ,, |

આ તપ આરો અને ચૈતરની શુદ્ધ ઉથી ૧૫ સુધી રોજ આંખેલથી કરવો. એમ વર્ષામાં એ વાર કરતાં સાડાચાર વર્ષે નવ ઓળી પૂરી કરવી; અને યંત્ર મુજબ કિયા, ગણુણું વિગેરે કરવાં, ત્રિકાલ દેવવંદન, પૂજા, પદિક્ષેહણા, પદિક્ષમણુદિ કિયા કરવી.

જ્ઞાનપંચમી તપવિધિ.

જે શક્તિ હોય તો દરેક ભાસની દર પંચમી અથવા અજવાલી પાંચમ કે છેવટ કાર્તિક શુદ્ધ પાંચમે તો જરૂર તેનું આરાધન કરવું તે દિવસ “નમો નાણુસ્સ” એ પદ્ધની ૨૦ નવકારવાલી ગણ્યની, પાંચ અથવા એકાવન દોગ્રસનો કાઉસગ્રા કરવો ને ખમાસમણું તેટલાં દેવાં વિગેર દરેક તપની વિશેષ વિધિ અન્ય સ્થળેથી જાણું દેવો.

દીવાલીનું ગરણું.

- | | |
|-------------------------------------|-----------------------------|
| ૧ શ્રી મહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમઃ એ | પદ્ધની નવકારવાલી વીશ ગણ્યની |
| ૨ શ્રી મહાવીરસ્વામિ પારગતાય નમઃ | “ ” “ ” |
| ૩ શ્રી ગોતમસ્વામિ સર્વજ્ઞાય નમઃ | “ ” “ ” |
-

“શ્રીનવપદજ્ઞના—ચૈત્યવંદન, સ્તવન, સંગ્રહ.”

૧

શ્રી સિદ્ધચક્ર નમસ્કાર ચૈત્યવંદન.

જે દુરી સિરિ અરિહંત, મૂલ દ્વદ્વ પીઠ પહંદ્રિયો;
સિદ્ધ ચરી ઉવજાય સાહુ, ચીહું પાસ ગરીદ્રિયો. ૧
દંસણું નાણું ચરિત્ય તવ હી, પડિસાહા સુંદરું;
તત્ત્વભર સરવગ્રા લદ્ધિ, શુરૂપયદ્વલ દુંખરૂ, ૨
હિસીપાલ જગ્ઘા જગ્ઘાણીણુ, પમુડ સુર કુસુમેહિં અલાં;
સો સિદ્ધચક્ર શુરૂ કૃપતરૂ, અમ મન વંછિય ફૂલ દીયો. ૩

૨

આર ગુણે અરિહંત દેવ, પ્રણુમીજે લાવે;
સિદ્ધ આઠ ગુણું સમરતાં, દુખ દ્વાહંગ જાવે. ૧

આચારજ ગુણુ છત્રીશ, પચવીશ ઉવકજાય;
સતાવીશ ગુણુ સાધુનાં, જપતાં શીવસુખ થાય; ૨
એમ અઠદોાતર ગુણુ મળીએ, એમ સમરે નવકાર;
ધીરવિમલ પંહિતાણે, નય પ્રણુમે નિત્ય સાર. ૩

૩

“ સામાન્ય જિન ચૈત્યવંદન. ”

જય જય તું જગનરાજ આજ, મળીએ સુજ સ્વામી;
અવિનાશી અકલંક રૂપ, જગ અંતરબામી. ૧
કૃપાઙ્ગી ધર્મહેવ, આતમ આરામી;
ચિદાનંદ ચેતન અચિંત્ય, શીવલીલા પામી. ૨
સિદ્ધ બુદ્ધ તું વંદતાં, સકળ સિદ્ધ વર બુદ્ધ;
રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ કર્ષ. ૩
કાળ બહુ સ્થાવર ગમ્યો, લભીએ લવમાંહી;
વિકલેંદ્રિય માંહી વર્ણે, સ્થિરતા નહિ કયાંહી. ૪
તિર્યાંચ પંચાંદ્રિયમાંહી હેવ, કરમે હું આંદોયો;
કરી કુકર્મ નરકે ગયો, તુમ દરીશન નહી પાયો. ૫
એમ અનંતકણે કરીએ, પામ્યો નર અવતાર;
હુએ જગતારક તુંહી મળ્યો, લવજલ પાર ઉતાર ૬

૪

શ્રી પાશ્વજિન ચૈત્ય વંદન.

જય ચિંતામણુ પાશ્વનાથ, જય ત્રિલુંનસ્વામી;
અષ્ટકર્મ રિપુ લુતીને, પંચમી ગતિ પામી ૧
પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ;
પ્રભુ નામે લવલય તણું, પાતક સખ દહીએ. ૨

ચોં હું વર્ષું જેડી કરીએ, જપીએ પાર્થું નામ;
વિષ અમૃત થઈ પરગમે, લહિએ અવિયત ઠામ. ૩

જિન પૂજાનું ચૈત્યવંદન.

ગણુમી શ્રી ગુરુરાજ આજ, જિન મંદિર તેરે,
પૂન્ય લખી કરશું સર્કલ; જિન વચન લાલેરો.
દેહરે જાવા મન કરે; ચોથાણું ક્રળ પાવે;
જિન જુહારવા ઉઠતાં, છદુ પોતે આવે;
જઈશું જિનવર લખીએ માર્ગ ચાલ્યતાં;
ઢાવે દ્વારશતણું પૂન્ય, લક્ષ્મિ માલાંતા;
અધ્યપંથ જિનવર તણ્ણુંએ, પંદરે ઉપવાસ;
દીઠો સ્વામીતણો ભુવન, લહીએ એક આસ.

જિનવર પાસે આવતા, છમાશી ક્રળ સિર્દ આવ્યા જિન-
વર ધારણે વર્ષી તપ ક્રળ લીધ ॥ સો વર્ષ ઉપવાસ પુન્ય
ગ્રહકિશ્ચ દેતાં ॥ સહસ વર્ષ ઉપવાસ પુન્ય, જે નજરે જો-
તાં ॥ ક્રલ ધણે કુલની માલ, પ્રભુ કંઠે ઠવતાં ॥ પાર ન
આવે ગીત નાદ, કેરાં ક્રલ થુંઘુતાં ॥ શિર પૂજ પૂજ ક-
રોએ, સૂર ધૂપતણો ધૂપ ॥ અક્ષત સાર તે અક્ષ્ય સુખ,
દીપ તર્ણ દીપ ॥ નિર્મલ તન મને કરીએ, થુલ્લતાં દીદ જ-
ગીશ ॥ નાટ્યક લાવના લાવતાં, પામે પહવી જગીશ ॥
જિનવર લક્ષ્મિ વલીએ, પ્રેમે પ્રકાશી ॥ સુલ્લી શ્રી ગુર વ-
યષુ સાર, પૂર્વ દૃષ્ટિ લાખી ॥ અષ્ટ કર્મને ટાળવા, જિન
મંદિર જઈશું ॥ લોટી ચરણું લગવંતના, હવે નિર્મલ થઈશું
॥ કર્તી વિજય ઉવજાયનો, વિનય કહે કરબોદ ॥ સર્કલ
હેલે મુજ વિનતિ, જિન સેવાનું તોડ ॥ ધરિ ॥

॥ અથ શ્રી સિદ્ધચક્ષુનું સ્તવન. ॥

॥ દેશી આછેલાલની ॥ સમરી શારદા માય, પ્રણુમ્ભિ
નિજશુરુ પાય ॥ આછે લાલ ॥ સિદ્ધચક્ષુણુ ગાયશું જી ॥
એ સિદ્ધચક્ષુણુ આધાર, લવિ ઉતરે લવ પાર ॥ આ૧૦ ॥ તે
ભણી નવપદ ધ્યાયશું જી ॥ ૧ ॥ સિદ્ધચક્ષુણુગેહ, જસ
શુણુ અનંત અચ્છેહ ॥ આ૧૦ ॥ સમરચાં સંકટ ઊપસમે
જી ॥ લહિયેં વંછિત લોગ, પામી સવિ સંનોગામના ॥
સુર નર આવી બહુ નમેજી ॥ ૨ ॥ કષ નિવારે એહ,
રોગ રહિત કરે હેહ ॥ આ૧૦ ॥ ભયણું સુંદરી શ્રી પાલને
જી ॥ એ સિદ્ધચક્ષુણુ પસાય, આપદા ફૂરેં જય ॥ આ૧૦॥
આપે મંગલ માલનેં જી ॥ ૩ ॥ એ સમ અવર નહીં કોઈ,
સેવે તે સુખીઓ હોય ॥ આ૧૦ ॥ મન વચ્ચાકાયા વશ કરી
જી ॥ નવ આંખિલ તપસાર, પરિક્ષેમણું હોય વારાઆ૧૦॥
દેવવંદન ત્રણ ટંકના જી ॥ ૪ ॥ દેવ પૂજે ત્રણ વાર, ગ-
ણણું તે હોય હળર ॥ આ૧૦ ॥ સ્નાન કરી નિર્મલ પણુ
જી ॥ આરાધે સિદ્ધચક્ષુ, સાનિદ્ધય કરે તેની શક ॥આ૧૦॥
જિનવર જન આંગે લણુ જી ॥ ૫ ॥ એ સેવો નિશ દીસ,
કહીયેં વીસવા વીશ ॥ આ૧૦ ॥ આલજંનલ સવિ પરિ-
હરે જી ॥ એ ચિંતામણિ રતન, એહનાં કીજેં જતન ॥આ૧૦॥
મંત્ર નહીં એહ ઊપરે જી ॥ ૬ ॥ શ્રી વિમલેસેર જશ,
હેંજે મુખપરતક્ષ ॥ આ૧૦ ॥ હું કિંકર છું તાહરો જી ॥
ધાર્મયો તુંહીજ દેવ, નિરંતર કરે હવે સેવ ॥ આ૧૦ ॥ હિ-
વસ વદ્યો હવે ચાહરો જી ॥૭॥ વિનતિ કરે છું એહ, ધર-
નો મુજશું નેહ ॥ આ૧૦ ॥ તમને શું કહીયેં વહી વહી

॥ ॥ શ્રી વદ્મીવિજય ગુરુ રાય, શિષ્ય કેસર ગુણુ જાય
॥ આ૦ ॥ અમર નમે તુજ લતી લતી અ ॥ ૮ ॥
૩ ધતિ ॥ ૧૪ ॥

॥ અથ સિદ્ધચક્ર સ્તવન. ॥

॥ અવસર પામીને રે, કીને નવ આંબિતની ઓલી ॥
ઓલી કરતાં આપદ જાયે, ઝડ્ધિ સિદ્ધિ લહિયે બહુલી
॥ આ૦ ॥ ૧ ॥ આશોને ચૈત્રે આદરશું, સાતમથી સા-
સાલીરે ॥ આતસ મેહેલો આંબિત કરશે, તસ ઘર નિલ્ય
દીવાલી રે ॥ અ૦ ॥ ૨ ॥ પૂતમને હિન પૂરી થાતે, પ્રેમેશું
પખાલો રે ॥ સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપ
માલી ॥ અ૦ ॥ ૩ ॥ દેહેરે જઈને દેવ જુહારો, આહે-
સર અરિહંત રે ॥ ચોવીશે ચાહીને પૂજે, લાવેશું લગ-
વંત ॥ અ૦ ॥ ૪ ॥ એ ટકે પડિછેમણું ઐદ્યા, દેવ
વંદન ત્રણુ ઠાલરે ॥ શ્રી શ્રી પાત તણીપરે સમજ, ચિ-
ત્તમાં રાખો ચાલ ॥ અ૦ ॥ ૫ ॥ સમકિત પામી અંતર
ભામી, આરાધી એકાંત રે ॥ સ્યાદાદ્યપથે સંચરતાં, આવે
લવનો અંત ॥ અ૦ ॥ ૬ ॥ સત્તર ચોરાણુયે શુદ્ધ ચૈ-
ત્રીયે, બારશે બનાવી રે ॥ સિદ્ધચક ગાતાં સુખ સુપત્તિ,
ચાલીને ઘેર આવી ॥ અ૦ ॥ ૭ ॥ ઉદ્યરતન વાચક
જિપદેશે, જે નર નારી ચાલે રે ॥ લવની લાવઠ તે ભાં-
શુને. મુક્તિ પુરિમાં ભાવે ॥ ૮ ॥ ॥ ધતિ ॥

॥ અથ આંબેલની ઓળીનું સ્તવન. ॥

॥ ઓ લવિ પ્રાણીરે સેતો ॥ સિદ્ધચક ધ્યાન સમે

નહીં મેવો ॥ એ ભવિ૦ ॥ એ આંકણી ॥ જે સિદ્ધયકુને
આરાધે, તેની કીર્તિ જગમાં વાધે ॥ એ ભવિ૦ ॥ ૧ ॥
પેહેલે પટેંડે અરિહંત, થીજે સિદ્ધ ખુધ ધ્યાન મહંત ॥
નીજે પટેંડે સૂરીસર, ચોથે જીવજાયને પાંચમે મુનિસર ॥
એ ભવિ૦ ॥ ૨ ॥ છુટે દરશન કીજે, સાતમેં જ્ઞાનથી
શિવ સુખ લીજેં ॥ આઠમેં ચારિત્ર પાળો, નવમેં તપથી
મુક્તેં જાવો ॥ એ ભવિ૦ ॥ ૩ ॥ એળી આંષેલની કીજે,
નોકારવાળી વીશ ગણીજેં ॥ ત્રણે ટંકનારે હેવ વાંદી જે,
પલેવણું પડિકમણ્ણા કીજે, ॥ એ ભવિ૦ ॥ ૪ ॥ ગુરુ મુખ
કિરિયારે કીજેં, હેવ ગુરુ લક્ષ્મિચિત્તમાં ધરીજેં ॥ એમ કહે
રામનો શિષ્ય, એળી જીજવને જગ દીશ એ ભવિ૦ ॥૫॥

॥ અથ શ્રી સિદ્ધયકુળનું સ્તવન. ॥

॥ સાંભળરે તું સજની મારી, રજની કયાં રમીઆવી-
જી રે ॥ એ દેશી ॥ શ્રી વીર પ્રબુ ભવિજનને એમ કહે,
ભાવ દ્વારા દિલ આણીજી રે ॥ સુરતર્દ સમ સિદ્ધયક આ-
રાધેા, વરવા શિવ વધૂ રાણી ॥ સુલભિયા સુણુનેજી રે ॥
શિવ કાર્યનું મુખ્ય કારણું નવપદ, છે ગુણી ગુણું પણ ચાર-
જી રે ॥ અરિહંત સિદ્ધ સૂરિ જીવજાયે, સાધુવર દરશન
ધાર ॥ સુલભિયા ॥ ૨ ॥ જ્ઞાન ચારિત્ર તપ એ નવપદનું,
આરાધન એણી પરેં કીજેજી રે ॥ આસો ચૈત્ર શુદ્ધ સાત-
મથી, આંબિલ એળી માંડીજે ॥ સુલભિયા ॥ ૩ ॥ ચૈ-
ત્ય પૂજા ગુરુ લક્ષ્મિ કરીએં, પડિકમણ્ણાં દોય ધારો જી ॥
ત્રણું કાળ હેવ વંદન કરીએં, ધ્રઘણ્યર્ય ભૂમિ સંથારો ॥

મુખવિયાં ॥ ૪ ॥ નેકારવાળી વીશ ગણ્ણીએં, એકેક પદની રંગેજીરે ॥ પઠહ અમાર સહા વજડાવી, સુલો આગમ ગુરુ સંગે ॥ મુખવિયાં ॥ ૫ ॥ કહે ધર્મચંદ સિદ્ધચક સેવતાં, લહીએં મંગળ માળજીરે ॥ રાજ્ય રિદ્ધ રમણી સુખ પામ્યો, નેમ નરપતિ શ્રીપાળ ॥ મુખવિયાં ॥ ૬ ॥

॥ અથ દીવાળીનું સ્તવન. ॥ ૨ ॥

॥ મારે દીવાળી રે થઈ આજ, પ્રભુ સુખ જોવાને ॥ સ્વરચાં સરચાં રે સેવકનાં કાજ, ભવ દુઃખ જોવાને ॥ એ આંકણી ॥ મહાવીર સ્વામી સુકૃતે પોહેતા ને, ગૌતમ કેવળ જ્ઞાનરે ॥ ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી મારે, વીર પ્રભુ નિવારણુ ॥ જિન સુખો ॥ ૧ ॥ ચારિત્ર પાણ્યાં નિરમળાંને. ટાણ્યાં તે વિષય કખાયરે ॥ એવા મુનિને વાંદી-એં તો, જિતારે ભવ પાર ॥ જિન સુખો ॥ ૨ ॥ બાકુળ વોહેરયા વીરજી ને, તારી ચંદન બાળા રે ॥ કેવળ લઈ પ્રભુ સુકૃતે પોહેતા, પામ્યા ભવનો પાર ॥ જિન સુખો ॥ ૩ ॥ એવા મુનિને વાંદીએં જે, પંચ જ્ઞાનને ધરતાંરે ॥ સમવસરણુ દઈ દેશનારે, પ્રભુ, તારચાં નર ને નાર ॥ જિન સુખો ॥ ૪ ॥ ચોવીશમાં જિનેસર્વને, મુક્તિ તણ્ણા દાતપારે ॥ કરબેદી કવિયણું એમ ભણેરે, પ્રભુ, ભવનો દૈરે ટાળ ॥ જિન સુખો ॥ ૫ ॥

॥ અથ શ્રી સિદ્ધચકજીનું સ્તવન; ॥

॥ કુંવર ગંભારો નજરે દેખતાં જી ॥ એ દેશી ॥

સેવો ભવિયા સિદ્ધચક્રને લુ ॥ ચિત્ત ચંચળતા નિવારીરે ॥
 શુણીને સેવ્યા ગુણુ સંપન્ને લુ ॥ એમ મન માંડે વિચા-
 રીરે ॥ સેવો ૦ ॥ ૧ ॥ ત્રિજગ પૂજય અરિહંત પ્રલુલ,
 ચોસઠ ઈદ્ર જેના દાસરે ॥ નાથને પંચ કલ્યાણુકેંલુ,
 સકળ જીવને હોચે ઉત્ત્વાસરે ॥ સેવો ૦ ॥ ૨ ॥ કર્મ
 ક્ષયેં સિદ્ધપદ લહુંલુ, વિશેષ સામાન્ય ઉપયોગીરે ॥ રૂપી
 અરૂપી ખટ દ્રવ્યનોલુ, ખેલ દેખે ને અનેગી રે ॥ સેવો ૦ ॥
 ॥ ૩ ॥ પંચ પ્રસ્થાને આચારજ ભલાલુ, સુનિ મન વિ-
 શ્રામ ઠામરે ॥ છત્રીશ છત્રીશોચેં શોભતાલુ, ગચ્છપતિ
 શ્રી પૂજય નામરે ॥ સેવો ૦ ॥ ૪ ॥ ગુણુ પચવીશ ઉવ-
 ગાયનાલુ, સત્ત્રદાની ઉપમા શોળરે ॥ જીવરાજ પરેં ગચ્છ
 ચિંતા કરેલુ, મીઠા ધક્ષુસમ ઓલરે ॥ સેવો ૦ ॥ ૫ ॥
 સાધ્યું મન તે સાધુ ભલાલુ, ચરણુ કરણુ ગુણુ આણુરે ॥
 નવ કદ્દી વિહૂાર ને આદરીલુ, ભવિતું ટાદ્યું અનાણુરે ॥
 સેવો ૦ ॥ ૬ ॥ મલ ઉપશમ ક્ષય ઉપશમેલુ ક્ષયથી
 ત્રિવિધેં હોચે નેહરે ॥ શઠશઠ ઓલે સોહામણોલુ, પ્ર-
 શુમું દર્શન તેહરે ॥ સેવો ૦ ॥ ૭ ॥ પાંચ લેહેં જાનીએ
 જાન કહુંલુ, પ્રત્યક્ષ પરોક્ષ લેહ સહિત રે ॥ અનપ્રીત
 અપ્રીત નયવળીલુ, ને વિસંવાદ રહિત રે ॥ સેવો ૦ ॥
 ૮ ॥ સંજમ સત્તર લેહેં હુયેલુ, નેહ આદરે હુઃખ જાય
 રે ॥ દિશા જગરણુ ઈડાં કહીલુ, સુરવધૂ નમે વળી પા-
 યરે ॥ સેવો ૦ ॥ ૯ ॥ દ્વાદ્શ લેહેં ને તપ ભણ્યોલુ, તે
 બાદ્ય અલ્યંતરથી હોચેરે ॥ ક્ષમા સહિત આરાધતાલુ,
 પાતિક ન રહે કોયરે ॥ સેવો ૦ ॥ ૧૦ ॥ એમ નવ પદ
 ગુણુ રત્નનોલુ, પારન લહે મતિમંતરે ॥ ખર્મચંદ્ર કર

ઓળિનેલ, કહે તારને ભગવંતરે ॥ સેવો ॥ ૧૧ ॥

॥ અથ શ્રી સિદ્ધચક્ષુનું સ્તવન. ॥

॥ શ્રીખ સાસુજ હેઠેરે વહુલ રહેણે દંગે ॥ એ દેશી ॥ સિદ્ધચક્ષુને ભજુએંરે ॥ કે ભવિયણુ ભાવ ધરી ॥
મદ માનને તજુએંરે ॥ કે કુમતા દ્વરકરી ॥ એ આંકણી ॥
ચેહેલે પદેં રાજેરે, કે અરિહંત ષેતતણું ॥ બીજે પદેં
છાજેરે, કે સિદ્ધ પ્રગટ ભણું ॥ સિદ્ધ ॥ ૧ ॥ ત્રીજે પદેં
પીળારે, કે આચારજ કહીએં ॥ ચૈથે પાઠ કરે, કે નીળ-
વરણુ લહીએં ॥ સિદ્ધ ॥ ૨ ॥ પાંચમે પદે સધુરે, કે તપ
સંજમ સૂરા ॥ શામ વરણે સોહેરે, કે દર્શન ગુણુ પૂરા ॥
સિદ્ધ ॥ ૩ ॥ દર્શન નાણુ ચારિત્રરે, કે તપ સંજમ
શુદ્ધ વરો ॥ ભવિ ચિત્ત આણીરે, કે હૃદયમાં ધ્યાન ધરો ॥
સિદ્ધ ॥ ૪ ॥ સિદ્ધચક્ષુને ધ્યાનેરે, કે સંકટ ભય ન
આવે ॥ કહે જૈતમ વાણીરે, કે અમૃત પદ પાવે ॥
સિદ્ધ ॥ ૫ ॥

॥ અથ શ્રી સિદ્ધચક્ષુનું સ્તવન. ॥

॥ નિદ્રડી વેરણુ હુધ રહી ॥ એ દેશી ॥ શ્રી સિદ્ધ-
ચક્ષુની આરાધિયે, જિમ પામો હો ભવિ કોડિ કલ્યાણુ કે ॥
શ્રી શ્રીપાલ તણી પરેં, સુખ પામો હો લહેણ ના-
ણુકે ॥ ૧૧ ॥ નવ પદ ધ્યાન ધરો સહા ॥ ચૈથે ચિત્તે
હો આણી બંડુ ભાવ કે ॥ વિધિ આરાધન સાચવો, જિમ
જગમાંહો હોયે જસનો જમાવકે ॥ નવ૦ ॥ ૨ ॥ કેશર
ચંદન કુસુમણું, પૂજને હો જવેખીયેં ધૂપ કે ॥ કુંદરું

અગરને અરગળા, તપ દીનતા હો કીજે ધૂત દીપકે ॥
 નવ૦ ॥ ૩ ॥ આશો ચૈત્ર શુક્લ પક્ષે, નવ હિવસ હો
 તપ કીજે એહુકે ॥ સહજ સેલાગ સુસંપદા, સોવન સમ-
 હો જલકે તસ હેહુકે ॥ નવ૦ ॥ ૪ ॥ જાવ જીવ શકૃતે
 કરે, જિમ પામો હો નિત્ય નવદા લોગ કે ॥ ચાર વરસ
 સાડા તથા, જિન શાસન હો એ મોહેટો ચોગકે ॥ નવ૦
 ॥ ૫ ॥ શ્રી વિમલહેવ સાનિધ્ય કરે, ચક્કેસરી હો હોએ
 તાસ સહાયકે ॥ શ્રી જિનથાસન સેહિયે, એહુ કરતાં હો
 અવિચલ સુખ થાય કે ॥ નવ૦ ॥ ૬ ॥ મંત્ર તંત્ર મણ્ય
 ઔધધિ, વશ કરવા હો શિવરમણ્ય કાજુકોાત્રિભુવન તિલક
 સમોવડી, હોએ તે નરહો કહે નય કુવિ રાજુકે ॥ નવ૦
 ॥ ૭ ॥ ॥ ઈતિ ॥

॥ અથ શ્રી દીવાલીનું સ્તવન. ॥

॥ વાદ્હાળીની વાટડી અમેં જેતાંરે ॥ એ દેશી ॥

॥ જય જિનવર જગ હિતકારીરે, કરે સેવા સુર
 અવતારીરે, ગૈતમ પસુહા ગણુધારી ॥ ૧ ॥ સનેહી વી
 રજુ જયકારીરે ॥ અંતરંગ રિપુને ત્રાસેરે, તપ કોપાણોપે
 વાસેરે, લણું કેવલ નાણુ ઊદ્વાસેં ॥ સ૦ ॥ ૨ ॥ કટિં
 કું વાહ વહાયરે, પણ જિનસાથેં ન ધટાયરે, તેણું હરિ-
 લંછન પ્રભુ પાય ॥ સ૦ ॥ ૩ ॥ સવિ સુરવહુ થેઈ થેઈ
 કારારે, જલપંકજની પરેં ન્યાશારે, તજુ તૃણુ લોગ વિ-
 કારા ॥ સ૦ ॥ ૪ ॥ પ્રભુ દેશના અમૃત ધારારે, જિનધર્મ
 વિષે રથાકારારે, જેણું તારયા મેધ કુમારા ॥ સ૦ ॥ ૫ ॥

ગौतમને કેવલ આલીરે, વરચા સ્વાંતિયે શિવ વરમાલીરે,
કરે જિતમ લોઠ દીવાલી ॥ સ૦ ॥ ૬ ॥ અંતરંગ અલ-
ઘુ નિવારીરે, શુભ સજાનને જિપગારીરે, કહે વીર પ્રભુ
દ્વિતકારી ॥ ૦ ॥ ૭ ॥ ॥ ઈતિ ॥ ૧૬ ॥

॥ અથ શ્રી વીરપ્રભુનું દીવાલીનું સ્તવન. ॥

॥ મારગ દેશક મોક્ષનોરે, કેવલ જ્ઞાનનિધાન ॥ ભાવ
દ્વારાસાગર પ્રભુરે, પર જિપગારી પ્રધાનોરે ॥ ૧ ॥ વીર
પ્રભુ સિદ્ધ થયા ॥ સંધ સકલ આખારોરે, હવે ઈલ્લ ભરત-
માં ॥ કોણુ કરશે જિપગારોરે ॥ વીર૦ ॥ ૨ ॥ નાથ વિ-
હુણું સૈન્ય જયુરે, વીર વિહુણુરે જીવ ॥ સાધે કોણુ આ-
ધારથીરે, પરમાનંદ અલગોરે ॥ વીર૦ ॥ ૩ ॥ માત્ર
વિહુણુ બાત જયૂરે, અરહે પરહે અથડાય ॥ વીર વિહુણુ
જીવડારે, આકુલ બ્યાકુલ થાયરે ॥ વીર૦ ॥ ૪ ॥ સંશય
છેછકવીરનોરે, વિરહ તે કેમ ખમાય ॥ જે દીઠ સુખ જિ-
પનોરે, તે વિષુ કેમ રહેવાયોરે ॥ વીર૦ ॥ ૫ ॥ નિયો-
મક ભવ સમુદ્રનોરે, ભવઅડાવ સથ્થ વાહ ॥ તે પરમેશ્વર
વિષુ મહેરે, કેમ વાધે જાત્સાહોરે ॥ વીર૦ ॥ ૬ ॥ વીર-
થકાં પણુ શ્રુત તણ્ણોરે, હતો પરમ આખાર ॥ હવે ઈહાં
શ્રુત આખાર છે રે, અહે જિનમુદ્રા સારોરે ॥ વીર૦ ॥ ૭ ॥
ત્રણુ કાલેં સવિજીવનેરે. આગમથી આણુંદ ॥ શેવો
ધ્યાવો ભવિજનારે, જિન પડિમા સુખકંદોરે ॥ વીર૦ ॥ ૮ ॥
ગણુધર આચારજ મુનિરે, સર્જને એળીપરેં સિદ્ધ ॥
ભવ ભવ આગમ સંગથીરે, દેવચંદ્ર પદ લીધરે ॥ વીર૦
॥ ૯ ॥ ॥ ઈતિ ॥

॥ અથ દીવાલીનું સ્તવન. ॥

॥ પ્રભુ કઠે ઠવિ કુલની માલા ॥ એ દેશી ॥

॥ રમતી ગમતી હમુને સહેલી, એહુ મલી લીજુચેં
એક તાલીરે સખી આજ અનોપમ દીવાલી ॥ લીલ વિ-
લાસેં પૂરણુ માસેં, પોષ દરમ નિશ્ચ રઢીયાલીરે ॥ સ૦
॥ ૧ ॥ પશુ પંખી વસીયાં વનવાસેં, તે પણુ સુખીયાં
સમકાલીરે ॥ સ૦ ॥ એણી રાત્રે ઘેર ઘેર ઓચ્છવ હોશે,
સુખીયાં જગતમાં નર નારીરે ॥ સ૦ ॥ ૨ ॥ ઊત્તમ અહુ
વિશાખા, જેગેં, જન્મયા પ્રભુજ જયકારીરે ॥ સ૦ ॥
સાતે નરકેં થયાં અજવાલાં, થાવરને પણુ સુખકારીરે ॥
સ૦ ॥ ૩ ॥ માતા નમી આડે દિગુકુમરી, અધોલોકની
વસનારીરે ॥ સ૦ ॥ સતી ધર ઈંશાનેં કરતી, જોજન
એક અશુચિ ટાલીરે ॥ સ૦ ॥ ૪ ॥ ઊદ્ધ્વ દોકની આડ
જ કુમરી, વરસાવે જલ કુસુમાલીરે ॥ સ૦ ॥ પૂરવ ઝ્યક
આડ હર્ષણુ ધરતી, દક્ષિણી અડ કલશાલીરે ॥ સ૦ ॥
॥ ૫ ॥ અડ પચ્છિમની પંખા ધરતી, ઊત્તર આડ ચમર
ઢાલીરે ॥ સ૦ ॥ વિદિશીની ચળી દીપક ધરતી, ઝ્યક
દીપની ચળી બાલીરે ॥ સ૦ ॥ ૬ ॥ કેલતણુ ધર ત્રણ
કરીને, મર્દન સ્નાન અલંકારીરે ॥ સ૦ ॥ રક્ષા પોટલી
ભાંધી બેહુને, મંહિર મેહેલ્યાં શાણુગારીરે ॥ સ૦ ॥ ૭ ॥
પ્રભુ મુખ કમલેં અમરી લમરી, રાસ રમતી લટકાલીરે ॥
સ૦ ॥ પ્રભુ માતા તુ' જગતની માતા, જગ દીપકની ધર-
નારીરે ॥ ૮ ॥ માલ તુજ નંદન ધણુ જ્વો, ઊત્તમ

શુવને ઉપગારીરે ॥ સ૦ ॥ છૈપન દિગ કુમરી ગુણ
ગાતી, શ્રી શુભવીર વચન શાલીરે ॥ સખી ॥ ૯ ॥
॥ ઈતિ ॥ ૮૦ ॥

॥ નવપદ સ્તવન.

વીરજીથુંદની વાણી, ચિત્ત ધરને અમિઅસમાણી;
હો ભવીયાં, નવપદ નિત્ય નિત્ય સેવો.. ॥ ૧ ॥
અરિહંત પદ સુખકારી, બીજે સિદ્ધ નમો હિતકારી;
હે ॥ ભ૦ ॥ ન૦ ॥ ૨ ॥
આચારજ સુવિચારી, ઉવાય તે શુત ઉપકારી હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૩ ॥
સત્તાવીશ ગુણધારી, એસે સાધુ નમો પ્રદ્યાચારી હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૪ ॥
હંસણ નાણુ નમીજે, વલી ચારિત્ર મહા તપ લીજે હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૫ ॥
કર્મ ગહુન તપ કાપે, એતો મનવંધીત સુખ આપે હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૬ ॥
સમર્યા સંકટ ભાજે, જસુ દિન દિન મંગળ છાજે હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૭ ॥
નવપદ જે નર ધ્યાવે, તે તો સુરનર શિવસુખ પાવે હો;
॥ ભ૦ ॥ ન૦ ॥ ૮ ॥
ભક્તિ વિલાસે જે ગાવે, તેતો સુરનર શિવસુખ પાવે હો;
॥ ભથ ન૦ ॥ ૯ ॥

શ્રી પદ્મવિજયજી કૃત શ્રી સિદ્ધચક્ર સ્તવન.

સિદ્ધચક્ર વર સેવા કીને, નરભવ લાહો લીજેલુરે,
 વિધિ પૂર્વંક આરાધન કરતા, ભવભવ પાતીક છીને,
 ભવિજન લલુયેલુરે, અવર અનાહિની ચાલ,
 નિત્ય નિત્ય તન્નિયેલુરે. એ આંકણી ॥ ૧ ॥

દેવનો દેવ દ્યાકર ઠાકર, ચાકર સુરનર ઈંદ્રલુ,
 ત્રિગડે ત્રિલુલન નાયક એઠા, પ્રણુમો શ્રી જિનચંદ. ભ. ૨
 અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંસણુ નાણીલ,
 અવ્યાખાધ અનંતુ વીર્યજ, સિદ્ધ પ્રણુમો ગુણુખાણી. ભ. ૩
 વિદ્યા સૈલાભ્ય લક્ષ્મી પીઠ. મંત્ર રાજ્યોણ પીઠલુ,
 સુમેરુ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈઠ. ભ. ૪

શ્રી સિદ્ધચક્ર સ્તુતિ ॥

વીર જીનેશ્વર અતિ અલવેસર, જોતમ ગુણુના દરિયાલ.
 એક દિન આણુા વીરની લઈને, રાજથણી સંચરીયાલ.
 શ્રેણીક રાજ વંદન આવ્યા, ઉલટ મનમાં આણીલ;
 પર્ષદ્વા આગલ બાર બિરારે, હવે સુણો લવી પ્રાણીલ. ૧
 માનવ લવ તુમે પુન્યે પામ્યા, શ્રી સિદ્ધ ચક્ર આરાધોલ.
 અરિહંત સિદ્ધ સૂરિ ઉંવાયા, સાધુ દેખો ગુણુ વાધોલ.
 દુરસણુ નાણુ ચારિત્ર તપ કીને, નવપદ ધ્યાન ધરીનેલ;
 શુર આસોથી કરવા આંબિલ સુખ સંપદ પીમીનેલ. ૨
 શ્રેણીકરાય જોતમને પૂછે, સ્વામીએ તપ કેણે કીધોલ.
 નવ આંબિલ તપ વિધિશું કરતાં, વંછિત સુખ કેણે લીધોલ

‘મધુરી ધ્વની બોલ્યા શ્રી ગોતમ સાંભળો શ્રેણીકરાંય વયણુંણ; રોગ ગયો ને સંપદા પાખ્યા, શ્રી શ્રીપાળ ને મૃથણુંણ. ૩ દ્વામ જુમ કરતી પાયે નેજીર. દીસે દેવી દ્વાપાલીણ; નામ ચક્કેસરીનેં સિદ્ધાઈ, આહિ જીનવર રખવાલીણ. વિજ્ઞ કોડ હુરે સહુ સંઘનાં, ને સેવે એના પાયણ; શાષ્ટ્રવિજ્ય કુવિ સેવક નય કહે, સાનિધ કરજે માયણ. ૪

—•—

॥ સિદ્ધચક્ર સ્તુતિ

શ્રી સિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હૈથડે હરખ અપાર,
જીમ લહો સુખ શ્રીકાર, મન શુદ્ધે ઓલી તપ કીજે;
અહેનિશ નવપદ ધ્યાન ધરીજે, જીનવર પૂજા રચિને
પદિક્ષમણું દોય ટંકના કીજે, આઠે થુદ્ધાએ દેવ વંદીજે.
ભૂમિ સંથારો કીજે, મૃખા તણો કીજે પરિહાર,
અંગે શિયલ ધરીજે સાર, દીજે હાન અપાર ૧
અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વે સુધુ વંદીજે,
દંસણુ નાણુ સુણીજે, ચારિત્ર તપતું ધ્યાન ધરીજે;
અહેનિશ નવપદ ગણું ગણીજે, નવ આંભિત પણુ કીજે,
નિશ્ચલ રાખી મન છો નિશ્ચ્યે, જપીએ પદ એક એક ઈશ;
નોકારવાલી વીશ; છેલ્લે આંભિત મોટો તપ કીજે,
સત્તરસેદી જિન પુજા રચીજે, માનવ લવ લાહો લીજે. ૨
સાતસેં કુદિયોના રોગ, નાઠા થંત્ર નમણુ સંબેગ,
દુર હુઆ કર્મના લોગ, અઢારે કેષ દુરે ભાગે;
દુઃખ દોહુગ દુર પતાએ, મન વંછિત સુખ થાય,

૧ મૌળી વાણી.

નિરધેનીયાને હે બહુધજન, અપુત્રિયાને હે પુત્ર રતન.
સેવે શુદ્ધ મન, નવકાર સમેં નહીં કોઈ મંત્ર;
સેવે લવિ હરખંત.

૩

જિમ સેવ્યાં ભયણ્યાં શ્રીપાળ, ઉમર દોગ ગયો સુખ રસાલ,
પાચ્યા મંગળમાળ, શ્રીપાલતણી પેરે જે અરાધે;
દીન દીન હોલત તસ ઘર વાધે, અતિ શિવ સુખ સાધે,
વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપણા કષ્ટને છર નિવારે;
હોલત લક્ષ્મી વાધે, મેધવિજય કવિયણુના શિષ્ય.
આણ્ણી હૈયડે ભાવ જગદીશ, વિનય વદે નિશદીશ.

૪

શ્રી સિદ્ધચક્રની સ્તુતિ.

જિનશાસન વંધીત પુરણુ દેવ રસાલ,
ભાવે ભવી ભણીયે, સિદ્ધચક ગુણુમાલ;
તિહું કાલે એહની, પુજા કરે ઉજમાલ,
તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ.

૧

અરિહંત, સિદ્ધ વંદો, આચારજ ઉવજાય,
મુનિ દરિસણુ નાણુ, ચરણુ તપ એ સમુદ્દ્રાય;
એ નવપદ સુમુદ્રિત, સિદ્ધચક સુખદ્રાય,
એ ધ્યાને ભવિનાં, ભવ કોટિ ફુઃખ ભય.

૨

આસો ચૈતરમાં, સુદિ સાતમથી સાર,
પુનમ લગે કીને, નવ આંબિલ નિરધાર;
દોય સહસ ગણેલું, પદ સમ સાડાચાર,
એકાશી આંબિલ તપ, આગમને અનુસાર.

૩

સિદ્ધચકનો સેવક, શ્રી વિમલેશ્વર દેવ,
શ્રીપાલ તણી પરે, સુખ પુરે સ્વયમેવ;

દુઃખ હોહુગ નાવે, જે કરે એહની સેવ,
શ્રી સુમતિ સુગુરનો, રામ કહે નિત્ય મેવ.

શ્રી સિદ્ધચક્રનો સ્તુતિ.

અરિહંતનમો વલી સિદ્ધ નમો, આચારજ વાચક સાહુન નમો.
દર્શન શાન ચરિત્ર નમો, તપ એ સિદ્ધચક્ર સદ્ગ પ્રણમો. ૧
અરિહંત અનત થયા થાશે, વલી ભાવ નિષેષે ગુણ ગાશે;
પદિકકમળાં દેવવંદન વિધિશું; આંબિલ તપ ગળુણું ગણોવિધિશું.
છહ રી પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવતરસે;
સિદ્ધચક્રને કુણ અદ્વે તેઃલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૨
સાડાચાર વરસે તપ પુરો, એ કર્મ વિદ્વારણું તપ શુરો;
સિદ્ધચક્રને મન મંદિર થાપો; નથ વિમલેસર વર આપો. ૪

॥ ઈતિ. ॥

નવપદજની સ્તુતિ.

પ્રહ ઉઠી વંહુ, સિદ્ધચક્ર સદ્ગાય,
જપીએ નવપદનો, જાપ સદ્ગાય સુખદાય;
વિધિપૂર્વક એ તપ, જે કરે થઈઉજમાલ,
તે સાવ સુખ પામે, જિમ મયણાં શ્રીપાળ. ૧

માલવપતિ પુત્રિ, મયણાં અતિ ગુણવંત,
તસ કર્મ સંઘેગે કોઢી મિલીએ કંત;
ગુરુ વયણે તે હો, આરાધ્યું તપ તેહ,
સુખ સંપદ વરિયા, તરિયા ભવજલ તેહ. ૨

આંબિલ ને ઉપવાસ, છટુ વલી અકુમ,
દશ અઠાઈ પંદર માસ, છ માસ વિશેષ;
ઇત્યાદિક તપ અહુ, સહુ માંહિ શિરદીાર.
જે ભવિયણુ કરશે, તે તરસે સંસાર. ૩

તપ સાનિધ્ય કરશે; શ્રી વીમલેસર યક્ષ.

સહુ સંધના સંકટ, ચુરે થઈ પ્રત્યક્ષ;
પુંડરિક ગણુધાર, કનકવિજય ભુદ્ધિ શિષ્ય,
અધ દર્શન કવિજય કહે, પહેંચે સકલ જગીશ. ૪.

॥ ઈતિ. ॥

શ્રી ગોતમ સ્વામીનો રાસ.

ઢાળ પહેલી.

વીર નિષેસર ચરણુકમલકમલા ક્યવાસો, પણુમણિ પભણિસુ
સાભિ સાલ ગોયમગુર રાસો; મણુ તણુ વયણુ એકંત કરવિ નિસુણુ
ઓ ભવિચા, નિભ નિવસે તુમ દેહગોહ ગુણુગણુ ગાહગણિઓ. ૧.
જાંયુદીવ સિરિભરહભિત્ત ખોણુતલમંદણુ, મગવદેશ જેનીય નરેસ
રીઉદ્ધલ ખલખંડણુ; ધણુવર ગુણ્ણર નામ ગામ જહિં ગુણુગણુ સજન
વિષ્પ વસે વસુભૂષ તથ્થ તસુ પુહવી ભજના. ૨. તાણ પુત સિરિદ્ધ-
ભૂષ ભૂવલય પ્રસિદ્ધો, ચુદ્ધલ વિજન વિવિહ રૂપ નારિ રસ વિદ્ધો
(લુદ્ધો); વિનય વિવેક વિચાર સાર ગુણુગણુહ મનોહર, સાત હાથ
સુપ્રમાણુ દેહરૂપે રંભાવર, ૩. નયણ વયણુ કર ચરણ નિષુવિ પંકજ
જળે પાડિઓ, તેજે તારાચંદ સૂર આકાશે ભમાડિઓ; રૂપે મયણ
અનંગ કરવિ મેલિછાઓ નિરધાડિઓ, ધીરમે મેર ગંભીર સિદ્ધુ ચંગિમ
ચયચાડિઓ. ૪. પેખવિનિરૂપમ રૂપ જાસ જણુ જર્પે કિંચિઅ, એકાકી
કલિભીતે ઈથિ ગુણ મેહદ્યા સંચિઅ; અહવા નિશ્ચે પુષ્પજનમે
નિષુવર ધર્મ અંચિઅ, રંભા પડુભા જોરિ ગંગ રતિ હા વિધિ
જાંચિઅ. ૫. નહિ અધ નહિ ગુર કવિ ન કોધ જસુ આગળ રહિઓ,
પંચસયાં ગુણુપાત્ર છાત્ર હીડે પરિવરિઓ; કરે નિરંતર યજાકર્મ
મિથ્યાભતિ મોહિઅ, ધર્મ છલિ હોસે ચરણનાણ દંસણુહ વિસોહિઅ. ૬.

પહેલી ઢાળનો અર્થ.

ગુનરૂપી લક્ષ્મીંચ જ્યાં નિવાસ કરેદો છે એવા વિરજિનેશ્વરના
ચરણુકમળને પ્રણુામ કરીને ગોતમ ગુરનો રાસ કહેશું. હે ભવ જીવો !
તમે તે (રાસ) મન વચન કાયાને એકાથ કરીને સાંભળો કે જેથી

તામારા દેહદ્વીપી ધરમાં ગુણુનો સમૂહ ગણગણાટ કરતો આવીને વસે. જાંખૂદીપમાં ભરત નામે ક્ષેત્ર છે. તેમાં પૃથ્વીતળના આભૂષણુ જેવો ભગ્ન નામે દેશ છે. ત્યાં રિપુ જે શરૂ તેના દળ કે૦ લસ્કરના બળનું અંડન કરનાર એલિક નામે રાજ છે. તે (ભગ્નદેશ) માં ધને કરીને એક (દ્રવ્યવાળું) ગુણ્યર નામે ગામ છે. ત્યાં ગુણગણુની થયા સમાન વસુભૂતિ નામે વિપ્ર (આલણુ) વસે છે. તેને પૃથ્વી નામે લાર્યા (સ્વી) છે. તેનો પુત્ર દીપભૂતિ નામે છે તે પૃથ્વીના વલયમાં (સર્વત્ર) પ્રસિદ્ધ છે; અને ચૈદ્વનિધાર્થ વિવિધ રૂપવાળા સ્વીના રસથી વિંધાયેદો છે અર્થાત् ચૈદ વિધામાં પ્રવીણુ છે, તેમાં લુણ્ય થયેલ છે. તે વિનય, વિકેક ને સાર વિચારાઈ ગુણુના સમૂહથી મનોહર છે. તેનું શરીર સાત હાથ પ્રમાણુ છે અને રૂપે કરીને રંભા-અપ્સરાના વર (સ્વામી) દીપ જેવો છે. તેના નેત્રકમળ, વદનકમળ, કરકમળ અને પદકમળ એવાં સુંદર છે કે જેણે ખીંડન પંકજ કે૦ કમળને તો જળમાંજ પાડી દીધાં છે અર્થાત् ત્યાંજ નિવાસ કરાવ્યો છે અને પોતાના તેજે કરીને તારા, ચંદ્ર અને સૂર્યને તો આકાશમાં ભમાડ્યા છે-ભમતા કરી સુધ્મા છે. રૂપે કરીને મહન કે૦ કામદેવને અનંગ-અંગ વિનાનો કરીને કાઢી મેલ્યો છે. ધૈર્યતામાં મેડ જેવો છે, ગંભીરતામાં સિંહુ કે૦ સમુદ્ર જેવો છે અને મનોહરપણુના સંચયનું સ્થાન છે. તેના નિરૂપમ (ઉપમા વિનાના) રૂપને જોઈને લોકો કાંઈક એમ કહે છે કે (વિધાતાએ) કળિકાળના ભયથી અધા ગુણુને આમાંજ એકઠા સંચી રાખ્યા છે; અથવા આણે પૂર્વનંભમાં જરૂર જિતેશ્વરને પૂછ્યા છે; તેથી તેણે રંભા, પદ્મા (લક્ષ્મી), ગોરી, ગંગા, રતિ અને વિધિ તે સર્વને વંચ્યા છે (હૃદ્યા છે). કોઈ યુધ (પંડિત), કોઈ ઝુર કે કોઈ કવિ તેની આગળ રહી શક્યા નથી અર્થાત् તે સર્વને આણે જીતી લીધા છે. (અહીં શ્વેતમાં યુધ, ગુરુ ને શુદ્ધ આ ત્રણેને જીત્યાનું સૂચયું છે). તે પાંચસે ગુણવાનું છાત્રો (શિષ્યો) થી પરવરેદો સર્વત્ર ફરે છે; અને ભયાત્વથી મોહિત ભનિવાળો હોવાથી યારું કર્મ કરે છે. પરંતુ તે હજેતેજ ભિષથી તેને અરણુ (ચારિત્ર), શાન ને

દર્શનની વિશુદ્ધિ પ્રાપ્ત થવાની છે: અર્થાત् તે કારણું ઉલ્લંઘને રત્નતરયીના લાભ માટે થવાતું છે.

વસ્તુ.

જાયુદીવહુ જાયુદીવહુ, ભરહવાસાંભિ, ભૂમિતળમંણુ, મગધદેશ,
સેણિયનરેસર, વર ગુવ્વર ગામ તિહાં, વિપ્ર વસે વસુભૂય સુંદરન;
તસુ ભજા પુહ્લી, સયલ ગુણગણુ ડ્રવનિહાણુ; તાણુ પુત વિજનનિદો,
ગોયમ અતિહિ સુનણુ. ૭.

અર્થ.

જાયુદીપના ભરતક્ષેત્રમાં, ભૂમિતળના મંડનભૂત મગધદેશમાં
ઓણિક નામે રાજ છે. ત્યાં એક ગુણ્યર નામે ગામ છે. તે ગામમાં
વસુભૂતિ નામે સુંદર વિપ્ર વસે છે. તેની ભાર્યા સકળ ગુણગણુના
નિધાનભૂત પૃથ્વી નામે છે. તેનો પુત્ર વિદ્યાવડે અલંકૃત અતિ સુનણુ
ગૈતમ નામે છે.

ભાષા. (ટાળ ખીજ)

ચરમ જિણેસર કેવળ નાણી, ચડવિહ સંધ પછ્છા જાણી;
પાનાપુર સામી સંપત્તો, ચડવિહ દેવ નિકાયહિ જુંસો. ૮. દેવે સમ-
વસરણુ તિહાં કીને, જિણુ દાઠે મિથ્યામતિ ખીને; ત્રિલુલનણુર
નિંધાસણે બેદા, તતભિષુ મોહ દિગતે પછ્છા. ૯. કોધ માન માયા
મદ્દપુરા, જાણે નાડા જિભ દિને ચોરા; દેવદુંદભિ આકારો વાને,
ધર્મનરેસર આચ્યા ગાને. ૧૦. કુસુમ વૃષ્ટિ વિરચ્યે તિહાં દેવા, ચડિસહ
દીજા માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે જિણુવર જગ
સંમોહે (સહુ મોહે), ૧૧. ઉપસમ રસભરભાર વરસંતા,
ચોજનવાણિ વખાણુ કરંતા; જાણિઅ વર્ધમાન જિન પાયા, સુરનર
કિંનર આવે રાયા. ૧૨. કાંતિસમૂહે જલઅલકંતા, ગયણુ વિમાણે
રણરણકંતા; પેખવિ ધંદભૂઈ મન ચિંતે, સુર આવે અમૃત યજ
હોવતે. ૧૩. તીર તરંક જિભ તે વહેતા, સમવસરણુ પહુંતા
ગાહગાહતા; તો અલિમાને ગોયમ જંપે, તિણે અવસરે કોપે તણુ
કંપે. ૧૪. મૂર્ખ લોક અનણ્યો ઓલે, સુર જાણુંતા ધમ કાંધ ડોલે;

ચૂ આગળ કો જણુ ભણીજે, મેર અવર કિમ ઓપમ દીજે. ૧૫.
અર્થ.

છેષાતીર્થિકર (શ્રી મહાવીર સ્વામી) હેવગરાતી થયા. પછી ચતુર્વિધ (સાધુ, સાધી, આવક, આવિકા) સંધની પ્રતિક્રિયા કરવાનો અનુસર જણી સ્વામી પાવાપુરે સંપ્રાત થયા [આવ્યા]. તેઓ ચાર પ્રકારની (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક) દેવનિકાય (દ્વિજાતિ) થી યુક્ત (પરવરેલા) હતા. ત્યાં [પાવાપુરીના ઉધાનમાં] હેવોએ સભવસરણ એવું કર્યું કે જેના દેખવાથી ભિથ્યામતિ અથવા ભિથ્યામતિવાળા જીવો ખીજે અર્થાત્ ઐદ પામે (નાખું થાય). તે સભવસરણમાં ત્રિભુવનયુદ્ધ [વીર પરમાત્મા] સિંહાસનપર આવીને ઐડા. તત્કાળ મોહ તો દિગંતમાં [દિશાના અંતમાં] પેસી ગયો, અને કોધ માન ભાયા ને ભણો રામ્ભ અથવા તેતે દેખવાળા જીવો તો પ્રલુને જોઈને જેમ દિવસે ચોર નાસી જય-સંતાઈ જય તેમ નાસી જવા લાગ્યા. આકાશમાં દેવદુંહલિ વાગવા લાગી તે ધર્મનરેશ્વર પધાર્યાથી ગાજતી ન હોય અથવા સાને ખર્મર આપતી ન હોય તેમ જણાવા લાગ્યું. દેવતાઓએ ત્યાં કુસુમની(જનુ પ્રમાણ) શૃષ્ટિ કરી અને ચોસઠ ધર્દો પ્રલુ પાસે સેવાની પ્રાર્થના કરવા લાગ્યા, અર્થાત્ 'તમારી સેવા અમને આપો ' એમ કહેવા લાગ્યા. પ્રલુના મસ્લક ઉપર ચામર ને છત રોલવા લાગ્યા, અને પોતાના રૂપે કરીને પ્રલુ જગતને મોહ પમાડવા લાગ્યા. પછી ઉપયમરસ્પી રસનો સભૂહ ભરી ભરીને પ્રલુ વરસવા લાગ્યા અને યોજન પર્યત[ચારે ખાળુ] સાંભળી શક્તય તેવી વાણીવડે વખાણ કરવા લાગ્યા, અર્થાત્ ધર્માપહેશ દેવા લાગ્યા. આ પ્રમાણે વર્ધમાન સ્વામીને પધાર્યા જણીને દેવતાઓ, મનુષ્યો, કિનરો (વ્યંતરો) અને તેના રાજાઓ આવવા લાગ્યા. તેમની કંનિના સમૂહે કરીને આકાશમાં જળજળાઈ થઈ રહ્યો અને આકાશ-માંથી ઉત્તરના વિમાનોવડે રણજણાઈ શર્મદ થઈ રહ્યો. તે જોઈને ચંદ્રભૂતિ (ગીતમ) વિષ્ણ મનમાં ચિંતવવા લાગ્યો કે આ દેવતાઓ અમારા યજ નિમિત્તે આવે છે. પછી તીરના તરંદની જેમ તે દેવતા-ઓ તો એકદમ વહેત્તા સતા ગહગહાઈ કરતા સભવસરણમાં પહોંચ્યો

ગયા. એટલે અભિમાનવડે જોતમ કહેવા લાગ્યા અને તે અવસરે .
કોપવડે તેમનું શરીર કંપવા લાગ્યું, (તેઓ શું કહેવા લાગ્યા ? આમ
કહેવા લાગ્યા કે]-મૃદ [મૂર્ખ] એવા લોકો (મનુષ્યો) તો અનાધ્યં
એલે અર્થાત અને સર્વજ્ઞને મુક્કીને ખીને ચાલ્યા જય-ખીજની પ્રશ્નં સાકરે,
યણું આ તો દેવતાએ જણું કહેવાય, છતાં તે આમ કેમ ડેલાયમાન
થાય છે ! આ હુનિયામાં ભારી પાસે-મારાથી અધિક ખીને જણું
ક્રાણું છે ? અને મેરુ ઉપરંતુ ખીજુ ઉપમાજ ક્યાં છે કે દેવાય ?
અર્થાત ઉંચામાં ઉંચી મેરુની ઉપમા છે તેને લાયક તો હું છું, છતાં
આમ કેમ થાય છે ? વરસ્તુ.

વીર જિણુંગર વીર જિણુંગર. નાણુસંપત્તિ, પાવાપુરિ સુરમહિંદુ
પતનાહ સંસાર તારણું, તિહિં દેવે નિમ્બવિચ સમોસરણું બહુ સુખ-
કારણું, જિણુંગર જગ ઉજનોઅફર, તજે કરી દિણુંકાર; સિંહાસણે
સામી ઠુંયો, હુંએ સુજયજયકાર ૧૬.

અર્થ.

વીરપ્રભુ કેવળજીનથી યુક્ત થયા પછી દેવપૂજિત સંસારથી
તારનાર એના તે નાથ પાવાપુરીએ પ્રાપ્ત થયા, અર્થાત પાવાપુરી
આવ્યા, ત્યાં બહુ સુખનું કારણું એવું સમોસરણું દેવોએ નિર્ણિત
કર્યું (રચ્યું). જગતમાં ઉદ્ઘોતના કરવાવાળા, તજે કરીને દિનકર
(સૂર્ય) નેવા જિનેશ્વર સ્વામી સિંહાસનપર અરાજમાન થયા અને
સર્વત્ર જયજયકાર થયો,

લાખા (ઢાળ ગ્રીલ.)

તવ ચંડિએ ધણમાણુગને, છંદસૂઈ ભૂદેવ તો, હું કારો કસ્તિ
સંચરિય, કવણુસુ જિણુંગર દેવ તો. ૧૭. યોજન ભૂમિ સમોસરણું
યેખે પ્રથમારંભતો દહદિસિ દેખે વિવિધ વધુ, આવંતી સુર
રંલ તો. ૧૮ મણિમય તોરણું દંડ ધજ, કોસીસે નવ ધાટ તો;
વયર વિવજિત જંતુ ગણુ, પ્રાતિહારજ આડ તો. ૧૯ સુરનર કિંતર
અસુર વર, હંડ દ્વારાણી રાય તો; ચિતો ચમક્કિય ચિંતવે એ, સેવ-
તા પ્રભુપાય તો. ૨૦. સહસ્રિરણુ સમ વીર જિણુ, પેખવે રૂપ વિશાળ

તો; એહ અસંભવ (વ) સંભવે એ, સાચો એ ઈદળળ તો ૨૧૦
તવ બોલાવે ત્રિજગ ગુરુ, ધંદ્ધૂધ નામેણુ તો; શ્રીમુખેઃ સંસય સામિ
સવે, ઝડે વેદ પણેણુ તો. ૨૨. માન મેલ્હી મહ ટેલી કરી ભક્તિએ
નામે શીસ તો; પંચ સયાંશું વ્રત લીચો એ, ગોયમ પહેલો શીસ
તો. ૨૩. બંધવ સંભળ સુણુવિ કરી, અગનિભૂધ આવેય તો; નામ
કેદ અન્યાસ કરે, તે પણું પ્રતિઓધેય તો, ૨૪. ધણે અનુકૂમે ગણ-
હર રયણુ, થાપ્યા વીરે અગ્યાર તો; તવ ઉપદેસે લુવન ગુરુ, સંયમ
શું વ્રત બાર તો. ૨૫. શિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત
તો; ગોયમ સંયમ જગ સયલ જ્યયજ્યકાર કરંત તો. ૨૬.^૧

અર્થ.

તે વખતે ધ્યદ્ધૂતિ ભૂદેવ (આહણુ) નિવડ ભાનરથી ગજ
ઉપર ચાંદો અર્થાત અલિમાને ભરાણો. તેથી હું કારો કરતો સતો
ચાલ્યો કે તે જિનવર દેવ કેણું છે ? આગળ ચાલતાં એક યોજના
ભૂમિમાં સમવસરણુનો પ્રારંભ કરેલો દીઠો, અને દરે દિશામાં વિવિધ
ચીચો અને સુરરંભા (દેવાંગના-અપ્સરાઓ) ને આવતી જોઈ.
વળી તે સમવસરણનાં મણીભય તોરણુ, હળર યોજનના દંડનાળા
ધર્મધ્વજ અને ગદ્ધના કોસીસા (કંગરા) ઉપર નવા નવા ધાટ
(વિચિત્ર રચનાના દેખાવ) દીઠા. તેમજ જાતિરંથી પણ રહિત
એનેપ્રાણીઓનો સમૂહ જોયો. આઠ પ્રતિહાર્ય દીઠા. વળી દેવો, મનુષો
વંતરો, લુવનપતિ દેવતાઓ, ધરો, ધંદ્ધાણીઓ અને રાજાઓને પ્રલુ-
ના ચરણકુમળની સેવા કરતા દેખી ચિત્તમાં ચભતકાર પામી ચિંતવવા
લાગ્યો. અને સહસ કિરણુ (સૂર્ય) સમાન તેજરવી તેમજ વિશાળ
દ્વારાંત વીર જિનને જોઈને વિચારવા લાગ્યો કે આ બધી અસંભ-
વિત વાત સંભવે છે-દેખાય છે, તેથી જરૂર આ સાચોસાચી ધંદ્રગા-
ળજ છે. (આમ વિચારે છે) તે અવસરે ત્રિજગગુરુ વીર પરમાત્માઓ

૧. આ ઢાળની દશ ગાથાને બદલે કેટલીક પ્રતમાં આઠ આઠ
પદ્ધતિ એકેક ગાથા કરી પાંચ ગાથા ગણેલ છે.

તેમને દૂરભૂતિ એવા નામથી બોલાવ્યા, અને સ્વામીએ શ્રીમુખે વેદના પહોંચાડે કરીનેજ તેમના સર્વ સંશય ફેરી નાખ્યા. પછી માનને મેલી (તળ દ્વારા) ભફેને ટેકી (દૂર કરી) ભક્તિવડે ભર્તાક નમાયું અને પાંચસે છાત્રો સહિત પ્રલુ પાસે પ્રત (ચારિત્ર) અંગીકાર કર્યાં. જોતમ (સર્વમાં) પહેલા શિષ્ય થયા. પોતાના મોટા અંધવ દૂરભૂતિએ સંયમ લીધાની વાત સાંભળી અભિભૂતિ પ્રલુ પાસે આવ્યા. પ્રલુએ નામ લઈને બોલાવ્યા. તેના મનમાં સંશય હતો તેનો અભ્યાસ કરાવ્યો, અર્થાત વેદપ્રદનો ખરો અર્થ સમજાવી સંશય ટાળ્યો એટલે તે પણ પ્રતિઓધ પાખ્યા. એ પ્રમાણે અનુકૂળે અગ્યાર ગણુધર રત્નોની પ્રલુએ સ્થાપના કરી અને તે પ્રસંગે ભુવનયુર (પ્રલુ) એ સંયમે [પાંચ મહાવત્તરપ] સહિત આવકનાં બાર પ્રતનો પણ ઉપદેશ આપ્યો. પછી જોતમસ્વામી નિરંતર પોતાના વિચારથીજ એ એ ઉપવાસે પારણું કરતા સત્તા વિચારવા લાગ્યા. જોતમ સ્વામીના સંયમે સકળ જગતમાં જયજયકાર કર્યો-વર્તાવ્યો.

વસ્તુ.

દૂરભૂતિ, દૂરભૂધાર, ચકિત બહુ માને, હુંકારોં કરિ કંપતો, સમોસરણે પહોંતો તુરત, અહ સંસા સામિ સવે, ચરમનાહ ફેરે કુરંત, બોધિ ધીજ સંજય મને, જોયમ ભવહ વિરત, દિખ્ય લઈ સિખ્યા સહિત, ગણુહર પય સંપત્ત. ૨૭

અથ્.

દૂરભૂતિ બહુમાને બડી હુંકારો કરતો ને કંપતો તરત સમોસરણે પહોંચ્યો. [અથ] પછી ચરમનાથ [વીરપ્રલુ] સ્વામીએ તેના સર્વ સંસા (સંશય) એકદમ ફેરી નાખ્યા, એટલે તેમના મનને વિષે બોધિથીજ (સમકિત) સંજન થયું (પ્રાત થયું). પછી જોતમ ભવ ને સંસાર તેથી વિરક્ત થયા, (પ્રલુ પાસે) દીક્ષા લીધી, શિક્ષા સહન કરી (અંગીકાર કરી) અને ગણુધરપદ પાખ્યા.

ભાગ (ઢાળ ચોથી)

આજ હુએ સુવિહાણ. આજ પચેલામાં પુષ્ય ભરો; દીક્કાં ગોયમ સાભિ, જે નિઅ નથેણે અભિય સરો. ૨૮. (સિરિ ગોયમ ગણુધ ર; પંચસયાં મુનિ પરવરિય; ભૂમિય કર્ય વિહાર, ભવિયણુ જન પડિઓછ કરે.) સભવસરણુ મજારિ, જે જે સંસય ઉપજોએ; તે તે પરઉપકાર, કારણે પુછે મુનિપવરો. ૨૯. જિલ્હાં જિલ્હાં દીજે દીખ, તિલાં તિલાં કેવળ ઉપજે એ; આપ કન્હે અણુહંત, ગોયમ દીજે દાન ઠેમે ૩૦ ગુરુ ઉપરિ ગુરુ ભત્તિ, સાભી ગોયમ ઉપનીય; એણિ છળ કેવળનાણ, ૨ ગજ રાખે રંગ ભરે. ૩૧. જ અદ્યપદ સેલ, વાંદે ચડિં ચડવીસ જિણુ; આતમલખાંધિ વસેણ, ચરમસરીરી સોય મુનિ. ૩૨. છય દેસણુ નિસુણેવિ, ગોદમ ગણુહર સંચલિય; તાપસ પત્રસંસ્થેણ, તો મુનિ દીઠો આવતો એ. ૩૩. તપસોસિય નિયઅંગ, અમહ સગતિ નવિ ઉપજે એ; કિભ ચડસે દઠ કાય, ગજ જિભ દીસે ગાજતો એ. ૩૪. ગિરુએ એણે અભિમાન તાપસ જાં અને ચિંતને એ; તો મુનિ ચડિઓ વેગ, આલાં. વિ દ્વિનકર કિરણુ. ૩૫. કંચણમણિ નિપ્પન, દંડ કુલસ ધજ વડ સહિઅ; પેખવિ પરમાનદ, જિણુહર ભરતેસર વિહિઅ. ૩૬. નિય નિય કાય પ્રમાણુ, ચર્ચદિસિ સંદુચ્ચ જિણુહ બિંબ; પણુમવિ મન ઉલ્હાસ, ગોયમ ગણુહર લિદાં વસિય. ૩૭. વધર સાભિનો જીવ, તિય કુન્ઝાંભક દેવ તિલાં; પ્રતિભોધે પુંડરીક, કુંડરીક અધ્યયન ભણ્ણી. ૩૮. વળતા ગોયમ સાભિ, સવિ તાપસ પ્રતિષોધ કરે; લેંચ આપણે સાથ' ચાલે જિભ જુથાંધિપતિ. ૩૯. ભીર ખાંડ ધૃત આણ, અમિયવૂઠ અંગુઠ ફિવિ, ગોયમ એકણુ પાત્ર, કરાવે પારણો સવિ. ૪૦. પંચસયાં શુલ્ભ ભાવિ, ઉજણા ભરિયો ભીરમસિ; સાચા ગુરુ સંઘેંગે, કેવળ તે કેવળ ૩૫ હુઅા ૪૧. પંચસયાં જિણુ નાહ, સભવસરણે પ્રાકરત્રય; પેખવિ કેવળ નાણ. ઉપન્દું ઉજણેયકરે. ૪૨. જાંબે જિણુવિ પીયુપ,

૧ આથા જૈન પ્રભોધમાં છપાયેલ છે પણ અંક ચડાનેલ નથી. લખેલ પ્રતોભાં નથી,

ગાજ તી ધણ મેધ જિમ; જિણવાણી નિસુણેવ, નાણી હુઆ પાંચસયે. ૪૩. ૧

વર્ણતુ.

ધણ અનુકૂમે, ધણ અનુકૂમે, નાણ સંપન્ન, પન્નરહસ્યપરિવર્તિયઃ;
હરિય દુરિય, જિણનાં વંદિં; જાણેવિ જગગુર વયણ, તીહનાણ
અપાણ નિંદિં. ચરમ જિણેસર તવ લણે, ગોયમ કરિસ મ એઉઃ;
છેહિ જઈ આપળે સહી, હોસ્યું તુલા એઉ. ૪૪,

અથ્.

આજ ભલું પ્રભાત થયું, આજ પસલી (ખોયા) - માં પુણ્ય
ભરો, શ્રી જૈતમ સ્વામીને દીડા એટદે પોતાના નેત્રમાં અમૃતનો આવ
થયો અથવા પોતાના નેત્રમાં અમૃતના સરોવર જેવા જૈતમ સ્વામીને
દીડા. હવે તે મુનિ. પ્રવર(મુનિમાં એઠ) જૈતમ સ્વામી પાંચસે મુનિની
સાથે પરવર્યાં સત્તા ભૂમિપર વિહાર કરે છે અને અનેક ભવ્ય જીવોને
પ્રતિષ્ઠાધ આપે છે સમવસરણમાં ને ને સંશ્ય ઉત્પન્ન થાય છે તે
પરઉપકારને માટે ભગવંતને પુછે છે, અને જ્યાં જ્યાં (જેને) જેને દીક્ષા
આપે છે લાં લાં (તેને તેને) કેવળજાન ઉત્પન્ન થાય છે. પોતાની
પાસે (કેવળજાન) નહીં છતાં પણ જૈતમ સ્વામી એ પ્રમાણે (કેવળ-
જાનનું) દાન આપે છે. ગુડ (વર્ધમાન સ્વામી) ઉપર જૈતમ સ્વામીને
અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ છે અને એ ભિષે કેવળજાન પામવાના
છે, પણ હાલ તો પ્રભુ ઉપરનો રાગ રોકી રાખે છે; અથવા રંગના
ભર (સમુદ્ર) થી પ્રભુ ઉપર રાગ રાખી રહ્યા છે હવે અન્યદી,
અદ્યાપદ શેલ (પર્વત) ઉપર પોતાની લબ્ધિવડે ચઢીને ને ચોવીશ
તીર્થ કરેને વાંદે તે મુનિ ચરમશરીરી હોય અર્થાત તે ભવમાંજ મેક્ષે
જનારા હોય.' આ પ્રમાણેની ભગવંતની દેશના સાંભળીને જૈતમ
ગણુધર અદ્યાપદ તરફ ચાલ્યા. (નજીક પહોંચ્યા એટટ) પંનરસે
તાપસે તેમને આવતા દીડા. (તાપસો વિચારે છે કે) ' તપથી
અમારું શરીર શેાપિત થઈ ગયું છે. તથાપિ અમને આ પર્વત ઉપર
પહોંચવાની(ચાલવાની) શક્તિ પ્રાપ્ત થઈ નથી, તો આ તો ૬૬ કાયા
વાળા છે, હાથીની જેવા ગાજતા દેખાય છે તે કેમ ચડી શક્શે ?
આવા મોગા અભિમાનથી તાપસો પોતાના મનમાં ચિંતવે છે તેવામાં

૧ આ દાળની ૧૬ ગાથાને કેટલીક પ્રતમાં ૮ ગાથા ગણેનું છે.

તો જૈતમ મુનિ સર્થનાં કિરણેતું આલંબન કરીને વેગે (ઉતાવળે) ચડી ગયા. ત્યાં કંચનમણિના નિષ્પત્ત થયેલા (અનાવલા) દંડ કણશુદ્ધ વિજન વિગેરે મોટા પ્રમાણવાળા જેની ઉપર છે. એવા લરતેશ્વરે અનાવેલા જિનધરને જોઈ પરમ આનંદ પામ્યા. તે જિનધરમાં ચોવીશે પ્રભુના પોતપોતાની કાયા પ્રમાણે ચારે દિશાએ સ્થાપન કરેલા (ચોવીશ) જિનઅંભને જોઈ અનના ઉલ્લાસથી પ્રમાણું કરીને જૈતમસ્વામી લંબાં [રત્ન] રહ્યા. તે સ્થાનકે (ભાવી) વજસ્વામીનો જીવ તર્યારીનું ભક્તાતીનો દેવતા આવ્યો. તેને જૈતમસ્વામીએ પુંડરીક કંડરીકનું અધ્યયન સંભળાવીને પ્રતિષ્ઠેાધ પમાહ્યે, ત્યાંથી પોઢા વળતાં જૈતમસ્વામીએ બધા (૧૫૦૦) તાપસોને પ્રતિષ્ઠેાધ કર્યો, અને (તેમને દીક્ષા આપીને) પોતાની સાથે લઘુયુથાધિપતિની જેમ ચાલ્યા. પછી ખીર ખાંડે ધી એક પાત્રમાંજ વહેરી લાવી તેમાં અમૃતની વૃષ્ટિવળો (અમૃતને વરસનારો) પોતાનો અંગુઠો રાખીને એક પાત્રમાં લાવેલ તે ક્ષીરાન્ધી સર્વ તાપસોને જૈતમસ્વામીએ પારણું કરાવ્યા. તે વખતે પાંચસે તાપસોને તોડિજવળ એવી ક્ષીરને ભિષે શુલ્ભ ભાવ થવાથી સાચા ગુરુના સંયોગે કવળ (ખીરનો કેળણાએ) તેજ કેવળજાન રૂપ થયા, અર્થાત્ પાંચસે તાપાસ મુનિ તો પારણું કરતાંજ કેવળજાન પામ્યા. પછી ખીજ પાંચસેને આગળ ચાલતાં જિનનાથનું સમવસરણું, તેના નણું ગઠ વિગેરે જોવાથીજ લોકાલોકમાં ઉઘોત કરનાર કેવળજાન થયું. પછી જિનેશ્વરની વાણી અમૃતની જેવી અને ધન મેધની જેવી ગાજતી સાંભળાને નીજા પાંચસે કેવળજાની થયા.

એ અનુકૂમે પત્રરસે કેવળજાની મુનિધી પરવરેલા જૈતમ ગણુધરે પ્રભુ પાસે જઈ, હુરિતનું હરણું કરી, જિન નાથને વાંદ્યા. ત્યાં જગુરુના વચ્ચનથી તેમને કેવળજાન થયાનું જણયું, એટસે કેવળજાન રહિત એવા પોતાના આત્માની જૈતમસ્વામી નિંદા કરવા લાગ્યા. તે વખતે ચરમ જિનેશ્વરે કણું કુણું કુણી હે જૈતમ ! તું એડ કરીશ નહીં; છેડે જતાં નક્કી આપણે બંને તુલ્ય થઈશું, અર્થાત્ બંને મોક્ષપદને પામશું,

ભાષા (ઢાળ પાંચ મી.)

સામીઓએ વીર જિણુંદ, પુનિમયંદ જિભ વિદ્ધસિય; વિદરિઓએ ભરહવાસંમિ, વરસ ખહોતર સંવસીય; હવતો એ કણુંય પઉ-મેસુ, પાયકમળ સંધહિ સહિય; આવિઓએ નયણુંદ, નયર પાવાપુરિ

સુરમહિય. ૪૫. પેણીઓએ ગોયમસાભિ, દેવસમા પ્રતિષ્ઠોધ કાંચે; આપણો એ ત્રિશલાહેવીનાંદન પહોંતો પરમપદે; વળતાં એ દેવ આકાશિ, પેખવિ જાણ્યો નિષુ સમે એ, તો મુનિએ મને વિષવાદ, નાદભેદ નિભ ઉપનેાએ. ૪૬. કુણુ સમેએ સામિય દેખ, આપ કન્હે હું ટાળિ-
ઓએ; જાણુંતો એ તિહુઅણુનાહ, લોક વિવહાર ન પાલિઓએ;
અતિ ભલું એ ક્રીધલું સામિ, જાણું કેવલ ભાગશે. એ; ચિંતબ્યું
એ ભાગક નેમ, અહોવા કેડ લાગશે એ. ૪૭. હું કિમ એ વીરજિ-
ણાંદ. ભગતે લોળો ભોળવ્યો એ; આપણોએ અવિહડ નેહ, નાહ ન
સંપે સાચવ્યો એ; સાચો છે. એહ વીતગાગ, નેહ ન જોહને લાલિઓએ
તિણેસમે એ ગોયમ ચિત; રાગ વિરાગે વાળિઓએ. ૪૮. આવતું
એ જે ઉલટ, રહેતું રાગે સહિયું એ; કેવળુંએ નાણ ઉપન, ગોયમ
સહેજે ઉમાહિયું એ; ત્રિલુચને એ જ્યજ્યકાર, કેવળિમહિમા સુર
કરે એ; ગાણુધર એ કરે. વખાણ, ભવિયણ ભવ નિભ નિસ્તરે એ. ૪૯.

વસ્તુ.

પદમ ગણાહર પદમ ગણાહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિય;
તીસ વરિસ સંજમ વિભૂસિય, ભિરિ કેવળ નાણ, પુણુ બાર વરસ
તિહુઅણુ નમંસિય; રાજગણી નગરી ઠુંબો, બાણુવય વરસાઉ; સામી
ગોયમ ચુણુનિદો, લોસ્યે સીનપુર ઢાક. ૫૦.

અર્થ.

શ્રી વીરજિનાંદ સ્વામી પૂર્ણિમાના ચંદ્રની નેમ વિલસાયમાનપણે
ભરતક્ષેત્રમાં ખહોંતેર વરસ સુધી વસ્યા ને વિચચ્છી. (પ્રાંતે) કનકના
ક્રમા ઉપર પગ સ્થાપન કરતા કરતા સંધે સહિત અને દેવોએ
પૂજિન એવા નયણાંદ (નેત્રને આંદ ઉત્પન કરનાર) સ્વામી પાવા-
પુરીએ આવ્યા. પછી જૈતમ સ્વામીને દેવશર્મા આલણને પ્રતિષ્ઠોધ
કરવા માટે મોકલ્યા. અને આપણું ત્રિશલા રાણીના પુત્ર પ્રલુ પરમપદે
(મોક્ષ) પહોંચ્યા. જૈતમ સ્વામીએ દેવશર્માને પ્રતિષ્ઠોધિને પાછા
વળતાં દેવતાઓને આકાશમા જોઈને જે વખતે એ વાત જાણી તે વખતે
તે મુનિના મનમાં જેમ નાદ ભેદ્યી (રંગનો ભંગ થવાથી) વિષવાદ
ચાય તેમ અત્યંત વિષવાદ ઉત્પન થયો. (જૈતમસ્વામી વિચરેછે કે)-
જાણી મુજલુને કૃયા સમયે (કૃતે વખતે) મને પોતાની પાસેથી ટાલ્યો
-દૂર કર્યો અત્રિલુચનનાથે લોકવ્યવહાર જાણતાં છતાં પણ પાણ્યો નહીં-

પણ પછ્યો નહીં: પણ હે સ્વામી ! અહુ સારુ કર્યું ! તમે જાણ્યું કે (જે અંતસમયે તને ભારી પાસે રાખીથ તો) એ કેવળજ્ઞાન ભારી પાસે ભાગશે, અથવા એમ ચિંતબ્યું જણ્યાય છે કે બાલકની જેમ કેડે લાગશે (કે મને સાથે લઈ જાઓ). પણ હું બોણો, એ વીર જિનેદની લક્ષિતમાં ભોળવાધ કેમ ગયો ? આપણો અવિહિત (નિવિદ સ્નેહ તે હે નાથ ! તમે સંપે કરીને સાચબો નહીં. પણ સાચું ! સાચું ! એ તો વીતરાગ ! જેને એક લાળ ભાત્ર પણ સ્નેહ (રાગ) છેજ નહીં (હતોજ નહીં) ભાટે મેં ભૂલ આધી ! આ પ્રમાણે વિચારિતે તે સમયે ગોતમસ્વામીએ પોતાનું ચિત્ત જે રાગવાળું હતું તે તે વિરોગમાં વાળી દાખું- તેથી ઉલટલર આવતાં છતાં જે રાગે કરીને પકડાયેલું (દૂર ને દૂર) રહેતું હતું તે (રાગ દૂર થવાથી) કેવળજ્ઞાન ગોતમસ્વામીએ સહેલે ઉપાજ્ઞન કર્યું અર્થાત તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ત્રણ લુવનમાં જ્યજ્યંકાર થયો, દેવતાઓએ કેવળનો ભહિમા કર્યો અને ગોતમ ગણુધરે વ્યાખ્યાન કર્યું (દેશના દીધી) કે જેથી બબ્લાંગો ભવ(સંસાર)થી નિસ્તાર-સંસારનો પાર પામે.

પ્રથમ ગણુધર, પચાસ વરસ ગૃહવાસે વસ્યા, ત્રીશ વરસ સંયાભથી વિલૂપ્તિ રહ્યા; શ્રી કેવળ જ્ઞાન બાર વરસ રહ્યું, ત્રણ લુવને નમસ્કાર કર્યો, પ્રાંતે બાણ વરસનું અયુષ્ય પૂર્ણ કરીને રાજબહીમાં નગરીમાં સ્થાપિત થયા. અર્થાત ગુણવાન ગોતમસ્વામી રાજબહીમાં ક્ષિવપુર સ્થાનને પામ્યા (મોક્ષ ગયા).

ભાષા (ઢાળ છઠી.)

જિમ સહકારે ક્રોયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમળ બહેકે, જિમ ચંદન સોગંધનિધિ; જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કુણ્યાચળ તેજે ઝળકે, તિમ ગોયમ સોલાગનિધિ. ૫૧. જિમ માન-સસર નિવસે હંસા, જિમ સુગ્વરશિરે કુણ્યવતાંસા, જિમ મહૂપર રાખ્ય વને; જિમ રયણુધર રયણે વિલસે, જિમ અંધર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણુ કેલિરવનિ. ૫૨. પુનિમ દિન(નિશિ) જિમ સસિહર સોહે, સુરતર જિમ જગ મોહે, પૂરવ દિસિ જિમ સહસકરેસ; પંચાનને જિમગિરિર રાને, નરવર્ધ ધરે જિમ ભયગલ ગાને, તિમ-
િનિ...સન મુનિખવરો, ૫૩. જિમ સુરતરવર સોહે સાખા, જિમ ઉતમ મુખે મહુરી ભાપા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિણુંદિર ધટા રણકે, ગોયમ લઘ્યે ગહગહે.

એ. ૫૪. ચિંતામણિ કરે ચિઠ્પણું આજ, સુરતર સારે વંધિત કાજ, કામકુલ સો વસ્તિ હુએ એ; કામગવી પૂરે મન કામી, અષ્ટ ભવા સિદ્ધિ આવે ધામી સામી ગોયમ અણુસર એ. ૫૫. પ્રણવાક્ષર પહેલો પભણીને, માયા ભીજ અવણું નિસુણીને; શ્રીમુખે (શ્રીમતિ) સોભા સંબન્ધે એ; દેવહ ધુરિ અરિહંત નમીને, વિનય પહુ ઉવાય થુણીને, ધર્ષણ મંત્રે ગોયમ નમો એ. ૫૬. પર પરપરવસતા કાંઈ કરીને, દેશ દેશાન્તર કાંઈ ભમીને, કવણ કાજે આયાસ કરો; પ્રહ ઉઠી ગોયમ સમરી ને, કાજ સવ તતભિણું તે સીજે, નવનિધિ વિલસે તાસ ધરે ૫૭ ચડિદહસે (ચડિદસય) બારેન્તર વરશો, ગોયમ ગણુધર કેવળ દી-વસં^૧) ખંબ નથર પ્રલુ પાસ પસાયે, કીયો કવિત ઉપગાર પરો; અ દિદ્હી ભંગળ ઓહ ભાણીને, પરવ મહોત્સવ પહિલો દિને, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ કરો. ૫૮.

ધન ભાતા જેણે ઉચરે ધરીયા, ધન પિતા જિણુ કુણે અવતરિયા, ધન સહગુર જિણુ દીભિયા એ; વિનયવંત વિદ્યાલંડાર, જસુ ગુણુ પુહવી ન લખે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ કરો (વડ જિભ શાખા વિસ્તરો એ. ^૨) ૫૯.

અર્થ.

જેમ આંખા ઉપર કેયલ રહુકારા કરે, જેમ પુણ્યના વનમાં સુગાંધ બહેંક્યા કરે, જેમ ચંદ્ન સુગાંધનું નિધાન છે, જેમ ગંગાનું જળ લહેરો વડે લહુકી રહ્યું છે, જેમ કનકાચળ (મેર) તેજવડે જળકી રહ્યો છે, તેમ ગોતમ સ્વામી સૌભાગ્યના લંડાર છે. જેમ માનસ સરોવર ઉપર હંસો રહે છે, જેમ ધંદના મસ્તક પર કનકના અવતસો (મુગટો) હોય છે, જેમ વનમાં મધુકર (ભભરા) ની શ્રેણિએ હોય છે, જેમ રતનાકર રતનોથી વિલસાયમાન (અલંકૃત) છે, જેમ આકાશમાં તારાએનો સમૂહ વિકસાયમાન હોય છે, તેમ ગોતમ રસામી ગુણોની કીડા કરવાની ભૂમિ (ડેળિવન) સમાન છે. પૂર્વિમાની રાત્રિએ જેમ ચંદ્રમા શોખે છે, કુલ્પવૃક્ષના મહિમાથી જેમ જગત બધું મોહ પામે છે, પૂર્વદિશાએ જેમ સૂર્ય પ્રકાશો છે, પંચાનન (સિંહ) વડે જેમ મોટો પર્વત શોખે છે, નરપતિ (રાજ)

૧ આ ગાથામાં ભીજ પદને બદલે આ પદ છપાયેલ છે.

૨ છેદ્ધા પદને બદલે આ પદ છપાયેલ છે, ને આ ગંડા એક પ્રતમાં નથી.

ના ધરે જેમ હાથી ગ્રહણ કરે કરે છે, તેમ આ મુનિ પ્રવર (મુનિ અંગ-જોતમસ્તકામી) થી જિનશાસન શોભી રહ્યું છે. જેમ કલ્પવૃક્ષની શાખાઓ શોભાયમાન હોય છે, જેમ ઉત્તમ પુરુષના મુખમાં અધૂર શાખા હોય છે, જેમ વનમાં કેતકી પુષ્પ મહામહાટ કરે છે, જેમ રાજ પોતાની લુજના અણથી ચમક્યા કરે છે, જેમ જિનમંદીરમાં ચંટ રણુકરા કર્યા કરે છે, તેમ જોતમ સ્વામી અનેક લખિયા વડે ગાહગલ્યા કરે છે. આજે (જોતમ સ્વામીને દીકા એઠલે એમ સમજવું કે) ચિંતામણિ રલ હાથમાં આવ્યું, સુરતર (કદ્વપૃક્ષ) સર્વ વાંછિત પૂરવા લાગ્યું, કામકુંભ પણ વશ થયો, કામધેતુ અનકામના પૂર્ણ કરવા તૈયાર થઈ, આહ મહા સિદ્ધિઓ (અણિમા લદ્ધિમાદિક) ધરે ચાલી આવી, માટે હવે હેલ્યો ! તમે જોતમ સ્વામીને અનુસરો. (તેમણે અતાવેલા માર્ગ ચાલો.)

(જોતમ સ્વામીને નમસ્કાર કરતાં) પ્રથમ પ્રણાવ અક્ષર (એંકાર) બોલવો, પછી માયા ખીજ (હૃદાંક) સાંભળવું (બોલવું), ત્યાર પછી શ્રીવડે શોભા કરવી, પ્રારંભમાં દેવ જે અરિહંત તેને નમબું, પછી વિનય પૂર્વક ઉપાધ્યાયને સ્તવવા, આત્માંત્ર વડે જોતમ સ્વામીને નમસ્કાર કરવો. (અંહું શ્રી અરિહંત ઉપાધ્યાય જોતમાય નમઃ)

હવે કહે છે કે તમે પર એવું પરવશપણું શા માટે અંગીકાર કરો છો ? દેશદેશાન્તર શા માટે ભેટો છો ? શા માટે ખીને પ્રયાસ કરો છો ? માત્રે પ્રભાતમાં ડીને જોતમ સ્વામીને સમરો, નેથી સર્વ કાર્ય તત્કાળ સિદ્ધ થાય અને તેના (તમારા) ધરમાં નવનિધાન વિલાસ કરે. (આવીને વસે). શૈ-દ્વારાં બારના વર્ષો (જોતમ સ્વામી કેવળસાન પામ્યા તે દિવસે-આસો વહિ ૦) સે) અંભાત નગરમાં પાર્શ્વપ્રલુને પમાયે આ ઉપકર કરવાવાળું કવિત બનાવ્યું છે. (વર્ષ, ભાસ, દિવસાદિકની) આધમાં માંગળિક તરફિ આ કવિતજ બોલવું, પર્વના મહોત્ત્વમાં પણ આ, કવિતને અયસ્થાન આપવું; કારણ કે આ રાસ ઋદ્ધ દૃદ્ધ ને કસ્યાણુ કરવાવાળો છે,

જે માતાએ આ (જોતમ સ્વામી) ને ઉદ્રમાં ધારણ કર્યા તેને ધન્ય છે, જેના કુળમાં એ અવતર્યા તે પિતાને ધન્ય છે, જે

સહયુક્તે તેને દીક્ષા આપી તેને પણ ધન્ય છે, વિનયવંત, વિદ્યાના અંડાર અને જેના ગુણોનો પૃથ્વીમાં પાર ન આવ એવા જૈતમુખ્યામી તમને ઋષિદ્વિષ્ણિને કલ્યાણુના કરનાર થાઓ. અથવા તેમની શાખા (શિષ્ય પરંપરા) વડની શાખાઓની જેમ વિસ્તાર પામા.

જૈન પ્રબોધમાં વધારે ગાથાઓ છપાયેલ છે તે નીચે પ્રમાણે—

જૈતમસ્વામીનો રાસ ભણીને, ચંડિવિહ સંધ રલિયાયત કીને, સયળ સંધ આણું દ કરો; કુંકુમ ચંદન છોડો દેવરાવો, ભાણેક મેતીના ચોક પુરાવો, રથણ સિંહાસણ એસાણું એ. ૬૦. તિણાં એસી ગુરુ દેશના દેશો, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદ્યવંત (વિજ્ય ભદ્ર) મુનિ એમ ભણે એ; જૈતમુખ્યામી તણો એ રાસ, ભણુતાં સુષુપુતાં લોગવિલાસુ, સાસય સુખ નિધિ સંપન્જે એ. ૬૧. એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લઘ્છી ધર આવે, મન વંચિત આશા રહો એ- ૬૨.^૨ અર્થ.

ઈતિ.

આ જૈતમુખ્યામીનો રાસ ભણીએ (ગણીએ) ચતુર્વિધ સંધને આનંદ ઉત્પન્ન કરાવીએ, સંકળ સંધ આણું દ પામો. (ભો ભણ્ય જીવો !) તમે કેશર ને ચંદનનો જમીન ઉપર છંકાવ કરાવો (ક્રેપ કરાવો) અને ભાણેકને મેતીના ચોક (સ્વરિતક વિગેરે) પુરાવો. તેનાપર રતનજડિત સિંહાસન મંડાવો; તે સિદ્ધાસનપર એક્ષીને જૈતમુખ્યામી (ગુરુ) દેશના દેશો, તે સાંભળવાથી અનેક ભણ્ય જીવોનાં કાર્ય સરશે. ઉદ્યવંત મુનિએ (આરાસના કર્તા) એમ કહે છે કે આ જૈતમસ્વામીનો રાસ ભણુતાં સાંભળતાં પ્રાણી આભવમાં ભોગવિલાસ પામે અને પરભને તેને શાશ્વત સુખનિધાન (મોક્ષ) સંપ્રાત થાય. આ રાસ જે ભણે ને ભણાવે તેના ધરમાં ઓછ હાથીએની લક્ષ્મી પ્રાત થાય અને તેના મનવાંચિત આશા સર્વ ઇગ્નિભૂત થાય.

શ્રી જૈતમસ્વામીનો રાસ અર્થ સહિત સંપૂર્ણ.

૧ છેદ્ધી ગાથામાં ત્રણું પદ છે, એટલે અરથી ગાથા છે. ગીળ ચોથી ટાળની ગાથાએની સંખ્યામાં ભદ્ર હોવાને લીધે જનપ્રાદ્યમાં કુલ ૪૮ ગાથાએનો અંક છે.

૨ કેાઠ પ્રતિમાં વિજ્યભદ્ર એવું નામ છે, પરંતુ તે નામ પણ એમનું જ છે.



અમારી આ સમા તરફથી સ
પુસ્તકો બહાર પાડવાનો પ્રબધ રચા
ન મે આ પુસ્તક બહાર પડેલું છે જી
પ્રેસ ડોપીઓ તૈયાર છે. અને થાય છે જો સહભૂકરથો - યા
મહાશાળેને વિનંતી કરવામાં આવે છે કે આપ આ સલા
નરથી કંઈ પણ કામ કરતા હુંછતા હોતો પત્ર જાવહાર
સુષુપ્તિના નાને કરવો.

જાહેર ખૂખર.

અમોદી હુમણીજ ચંદુલ સુખદાલ એન્ડ કુપનીના
નામથી તમામ જતના પુસ્તકો છારાના કાગડોની મોટી
હુંઠન જોલી છે સાથે તમામ જતના જૈન પુસ્તકો પણ
અમારે ત્યાંથી મલશે.

બાળાનુ ઠંડાનુ.

આરસ ઉમેદચા

લો. પાંજરાપાટી - અનાના